




આનગી ફરમાન

સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતારના
ફરમાન મુબારક
(ફક્ત શીયા ઇમામી ઇસ્માઇલીયો માટે)

सरकार आगा सुलतान मुहम्मद शाह दातारना
इरमान मुबारक

पानगी इरमान

इकत जैतुलप्याल मंडणी माटे



મુંબઈ મોટા જમાતખાના બૈતુલખ્યાલ

૨૦-૯-૧૮૯૦.

હક મોલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

હમણાં મોહરમના દિવસો છે, તેટલા માટે અમો તમોને ગમ કરવાનું ફરમાન કરીએ છીએ, પણ એ ગમ કેવો કરવો તે સાંભળો. હાઝર ઈમામને ઓળખી મારીફતનો ગમ કરવો. કુટવું, પીટવું અથવા રોવું એ ગમ નથી. અમો બીજી વખત ફરમાવીએ છીએ કે હાઝર ઈમામને ઓળખી મારીફતનો ગમ કરવો, એ સીવાયના ગમ છે તે ખોટા છે; ત્રીજી વખત ફરમાવું છું કે હાઝર ઈમામને ઓળખીને મારીફતનો ગમ કરવો. એ મારીફતને ઓળખવા સીવાય બધું ખોટું છે, તમારા ઈમામ હયાત બેઠા છે, તેટલા માટે મારીફતનો ગમ કરવો, તે પણ હાઝર ઈમામને ઓળખીને મારીફતનો ગમ કરશો તો તમને ફાયદો છે.



કરાંચી

તા. ૨-૭-૧૯૦૦

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

મુખી કારભારી અને ખાસ પંજેભાઈઓને કહીએ છીએ
કે તમો જલદી ખુદાના દિદારને પહોંચો અને આ ક્રિયાઓ
ઉપર અમલ કરો: જે ખોટું ન બોલવું, નિંદા ન કરવી.

૧. ખરાબ વસ્તુ ન વાપરવી.

૨. કાળ કીધ ન કરવો.

૩. સ્પર્શ ઈન્દ્રિય વશ રાખવી. અર્થાત બદનજર ન
કરવી.

૪. દરેક ઠેકાણે ખુદાને હાઝર સમજવું.

૫. સંગત સારા જ્ઞાનિ માણસની કરવી, બીજા કોઈની
ન કરવી.

૧. લોભ ૨. લુચ્યાઈ ૩. ખોટી સાક્ષી ૪. આપ
હત્યા ૫. બાળ હત્યા ૬. ચોરી, આ બધી વાતો
ગુનાહોની છે, તેમાંથી એક કરશો તો બધા ગુનાહો સામેલ
થશે, તેમાં સંભાળીને ચાલવું, પોતાના ખુદાને હાઝર કરી
જાણવું, ગુન્હાના કામથી હંમેશા દૂર રહેવું. જે ખુદાતાલાએ
ફરમાવ્યું છે તેના ઉપર પળેપળ ધ્યાન આપી ચાલવું અને
ખુદાને હાઝર સમજવું.

૧. વધુ બોલવું ન જોઈએ. ૨. વગર પૂછીયે જવાબ

ન આપવો કારણ કે મગજની નુકસાની છે, તેથી ધ્યાનની પણ નુકસાની છે કે બેઠક નહીં થશે અને પારકો હક ખાઈ જવો ન જોઈએ.

૧. પોતાનો હકનો ધંધો. ૨. દશોંદ ચોખી આપી પછી ખાવું. પારકું ખાવાથી દિલમાં અંધારું થાય છે જે હરગીઝ ન ખાવું. ૩. રાતની ફરમાન બરદારી બરાબર થાય. રાતના પણ જુમેરાત તથા સોમવાર રાતના બાર વાગે બૈતુલખ્યાલમાં હાઝર થવું. બીજી રાતોએ એક વાગે હાઝર થવું. હંમેશા છ વાગ્યા સુધી કામ પર કાયમ રહેવું. પછી પોતાનો ધંધો કરવો, તેમાં પણ હંમેશા ફરમાનને યાદ કરવું. કારણ કે મરી જવું છે, દુનિયા ફાનિ છે, આપણે પણ ચાર ઘડિના મુસાફર છીએ. તેમાં મોતને યાદ કરીએ. ઝીકર ફિકરમાં હોંશિયાર રહેવું. ગુન્હાના કામથી દૂર રહેવું, પોતાના ખુદાને હાઝર કરી સમજવું. ધંધો રોજગાર કરવો તેમાં આખો દિવસ બેલની માફક ઘણું ન કરવું. પેટના ગુજરાન વાસ્તે કરવું તેમાં પાંચથી છ કલાક ધંધો કરવો, તેમાં જે કિસ્મતમાં હશે તે જ મળશે. શુખર કરવો. નિંદર કરવી તેમાં છ સાત કલાક આરામ કરવો. તેમાં કંઈ રાતના કંઈ દિવસના, પણ ફરમાન બરદારીમાં ચુકવું નહિં પળેપળ ફરમાનને યાદ કરવું, જે પોતાના ખુદાએ ફરમાવ્યું છે તેના ઉપર ઇન્સાનને, જે કીરીઉ છે તે ફરમાનની કીરીઉ અવ્વલથી આખર સુધી પાળવી તેમાં હરગીઝ ચુકવું નહીં.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામ સરી જંગબારમાં બાઈઓવાળા જમાતખાનામાં પધાર્યા ને બાઈઓને ફરમાવ્યું કે :

અમોને ફરમાન કરવાની ઘણી ઉમેદ છે, પણ અહીંયા મોટા કાંગવાવાળી બાઈઓ તથા વગર કાંગવાવાળી બાઈઓ છે તેના માટે આસ્તે ફરમાવીએ છીએ જે તમો પછી બધાને સંભળાવજો. તમો આ કામ મોટા કાંગવાનું કરીને એક બીજા સાથે વાતો કરો છો અને પૂછો છો તે ઘણું ખરાબ છે. એ ઘણું પાપ છે, એના જેવો બીજો કોઈ મોટો ગુનો નથી અને એ વાત કરનારને ખુદા પૂછશે કે તે શા માટે વાત કરી અને પૂછવાવાળાને પણ પૂછશે કે તે શા માટે પૂછ્યું ? ત્યારે શું જવાબ આપશો તે કહો, જે અમો આ જવાબ આપશું. તમે જ્યાં સુધી પગે ચાલો છો ત્યાં સુધી ઘણું સારું છે પણ ત્યાં ઘણું મુશ્કીલ છે તેની ફિકર કરજો. જેમ તમે મોટા કાંગવાવાળી બાઈઓ છો તે એક બીજાને જોઈને કાંગવો ભરો છો પણ પ્રથમ ખબર નથી કે શું કરીએ છીએ, તે અમો તમને ફરમાવીએ છીએ કે પ્રથમ તમો ખુબ વિચાર કરો કે અમો શું ફરમાવીએ છીએ કારણ કે કોઈ કામ કરો તો પ્રથમ ખુબ સમજો. ઈન્સાન ભાર

ઉપાડે તે પ્રથમ વિચાર કરે જે આ મોટો ભાર તે મારાથી
ઉપડશે, તે ખુબ વિચાર કરીને ઉપાડે. જે ભાર ઉપાડવાનો
છે તે ભાર શું છે :

૧. બદનઝર ન કરવી.
૨. પારકો માલ ન ખાવો.
૩. ખોટું ન બોલવું.
૪. કોઈની ગીલા ન કરવી.
૫. કોઈની હસદ ન કરવી.
૬. વધારે હસવું કે સારું પહેરવું કે વધારે ખુશી કરવી
તેની પરેજી રાખવી જોઈએ, તે ભાર મોટો છે.

બીજું ફરમાવ્યું કે ઘણી ઈશનાશરી હોય તો પણ
સમજાવવાથી તે દીનમાં આવે. જે તેની ખિજમત કરીને
તેના હુકમ પર રહી, પોતાના લક્ષણ સારા કરે, અગર
ઈશનાશરી હોય ને છેલ્લા દમ સુધી સુધરે ને દીનમાં આવે
તો જન્મમાં જશે. અગર મોટું કામ કરીને કોઈ પાસે વાત
કરી તો તે જહન્નમમાં જશે. માટે તમો તમારા લક્ષણ
સારા કરો અને એવી રીતે ચાલો કે માણસો સમજે કે શું
આ ફીરસ્તા છે કે દેવતા લોક છે, તે પણ તમારી તારીફ કરે,
ને જો તમો બરાબર પચરવી કરો અને સારી

ચાલથી ચાલો તો પાંચ વરસમાં તમને બધું સુજી
આવે.

બીજું અમો તમોને ફરમાન કરીએ છીએ તે એક
કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખશો તો તમને શું
ફાયદો થશે. કાંઈ પણ નહીં થશે. માટે તમે એક કાનથી
સાંભળી બીજા કાનથી કાઢી ન નાખજો પણ તમો કાઢી
નાખો એવા છો, અમો તમને સારી રીતે ઓળખીએ છીએ,
માટે તમે એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી ન
નાખજો અને જો તમારાથી બની શકે તોજ આ કામ કરજો
અને હવે આજથી આ કામની ઘણી તજવીજ અને ઘણી
ફીકર રાખજો. ધરમ સારો હોય અને તેના પર ચાલવાવાળો
ખરાબ હોય તો તેમાં ધરમનો શું વાંક ? ધરમનો વાંક કાંઈ
પણ નથી, બધું તમારા હાથમાં છે.



મુંબઈ,

૨૨-૪-૧૯૦૨.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે વાડીના હૉલમાં, કાંડીમોહલ્લાના જમાતખાનાની બૈતુલખ્યાલના પંજેભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે જેણે મોટું કામ ન કર્યું હોય તે નીચે ચાલ્યા જાય. બાદ ફરમાવ્યું કે :

૧. પહેલી શરત એ છે જે કોઈની ગીબત ન કરવી.
૨. બીજી શરત એ છે જે કોઈને બેઅદબીથી ન બોલવું.
૩. ત્રીજી શરત એ છે જે દીનમાં હોશિયાર રહેવું.

અને જે દુઆ ન પડે તે કાફર છે. તમે હમણાં માથે બેઠા છો અને દીવાલનો પાયો કાચો હોય તો પડી જશે. તમારો પાયો મજબૂત હશે તો રહેશે. કાચો હશે તો પડી જશે. બીજું ફરમાવ્યું કે તમો સુન્નીઓની કિતાબો અને બૈત પડો છો તેમાં શું ફાયદો છે ? એવી કિતાબો ન વાંચો. એવી કિતાબો વાંચવાથી દીનમાં અને દુનિયામાં કાંઈ ફાયદો થશે નહીં, આપણું ઈલમ ઘણું છે, એક બે કિતાબો નથી, ઘણી છે, હઝારો છે. તમે આપણી ધાર્મિક કિતાબો મુકીને

સુત્રીઓની તથા કબીરાની તથા અબદલ કાદર
 જીલાનીની વાંચો છો તેમાં શું ફાયદો છે ? હમણાં હકીકતી
 મિજલસમાં બેઠા છો, અમો તમોને સમજાવીએ છીએ જે
 તમારો શક કાઠી નાખો તેટલા માટે આ ફરમાન છે જે
 તમો બગદાદી અલી મુલાની કિતાબો વાંચશો તો અમારા
 દીનમાંથી નીકળી જશો. તમો શેતાનની બાજી ન ખાજે.
 ઈ-સાન અને શેતાનમાં ફરક નથી. બદ ઈ-સાન શેતાન
 માફક છે. ફરમાવ્યું જે ઈબાદતમાં તમારા જેવી ઈબાદત
કોઈ પાસે નથી. તમારા પાસે સોનાનો ગાંગડો છે અને
 બીજાઓના સોનાના ગાંગડાની પૂછવાની શું જરૂર છે ?
 તમો તમારા સોનાના ગાંગડાની સંભાળ કરજો. બીજાનો
 લેવા જશો તો ચોરી છે. તમારા પાસે જે ગાંગડો છે એ
 જ હલાલ છે. બીજા પાસેથી લેશો તો હરામ છે. આ
સોનું હકીકતી છે. આજ સોનું તમોને કામ આવશે.
 બીજું સોનું જોશો તો ચોરી છે. તમો તમારા દીન પર
 મજબૂત રહેજો. તમો તમારા દીનના માટે જાન, માલ,
ઔલાદ, બધું કુરબાન કરો. ફરમાવ્યું તમો મોટું કામ કરો
 છો તે શું સમજો છો ? તમો કાંગવો ભરો છો તે લવીંગના
 ખોબા ભરીઆ એટલે બસ, એમ નથી. ફરમાવ્યું જે તમો
 કાંગવો ભરો છો તેમાં પહેલો ખોબો ભરો છો તેનો મતલબ એ
 છે જે તમારી ઝબાન અમોને આપી, બીજા ખોબામાં જીવ અને
 શરીર આપ્યું. ત્રીજા ખોબામાં પોતાનો અસલ રૂહ કાયમ છે,

જેને કાલીબ પણ કહેવામાં આવે છે, તે પણ અમોને સોંપ્યો છે. આ ત્રણે ચીજો તમોએ ગીરવી રાખી છે તે તમો લઈ લીઓ છો. તમોએ જે બૈયત કરી છે તે કોઈ વખતે પણ તોડી ન નાખજો. બીજું ફરમાવ્યું કે તમો દીનની ખિદમત કરો છો તે કાંઈ મોટાઈના માટે નથી કરતા. જેઓ એમ સમજે છે કે હું મોટો છું, એજ કાલે નાનો થશે. જે આજ નાનો છે તે કાલે મોટો થશે. જ્યારે તકબુરી આવશે ત્યારે જો સાતમા આસમાન માથે ચડેલો હશે તો પણ સાતમા જહન્નમમાં પડશે. મોમન એ છે જે તકબુરી ન કરે. મોમનને તકબુરી ન કરવી. જેઓ નાના છે તે ખુદા પાસે મોટા કહેવાશે. જો તમે ગરીબી રાખશો તો ખુદાની હુઝુરમાં મોટી બાદશાહી માથે જશો. જો અહીં મોટાઈ કરશો તો ત્યાં નીચા પડશો.

૫

મુંબઈ,

૨૪-૧-૧૯૦૩.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામને મોટે ખાને બૈતુલખ્યાલમાં મોટા કામવાળાઓએ મહેમાની કરી તે વખતે ફરમાવ્યું કે :

૧. તમો મોમનનું એક લશ્કર છો.
૨. ઝીકર બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છો, યાને ફૂલ છો અને બીજા જે છે તે ઝાડ છે.
૩. તમે એવી રીતે મહેનત કરો કે ફૂલ થાઓ.
૪. બગીચામાં તડકા અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ કરમાય જાય છે તેવી રીતે તમો બુઝરગી અને વડાઈ માથે એવી મહેનત ન કરો કે જેથી તમારા દિલનું ફૂલ કરમાય જાય.
૫. તમો હમણાં એવી મહેનત અને ખિદમત કરો કે જેમાંથી ઈશ્ક અને મોહબ્બત પેદા થાય. અમારા ઘરની ખિદમત ઘણા તરેહની છે, તેમાં ઈશ્ક અને મોહબ્બતથી - દિલની મહોબત કરો.
૬. તમો દસ જણા એક વખતે એક દિલ થાઓ તો એક વખતે આખી દુનિયાને તોડી નાખી અને ફરી પાછી બનાવી શકો.
૭. એક બાજુ થોડીવાર બેસીને અમારા કલામનું ધ્યાન, ફરમાનનો ખ્યાલ કરો. બાદ ઘણી આશિષ ફરમાવી.

૬

મુંબઈ,

૨૬-૭-૧૯૦૩.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે જંગબાર તથા કરાંચી જમાતની મોટા કામની મહેમાની કબૂલ કરીને દુઆ ફરમાવી અને ફરમાવ્યું:


તમો બધી જમાત એકદિલ નથી જેથી અમો ઘણાં જ દિલગીર છીએ, અમો તમારા સરદાર છીએ, તમો જમાત લશ્કર છો. પણ જો લશ્કર બેદિલ હોય તો સરદાર શું કરે ? તમો દુનિયાની મોટાઈ છોડી દીઓ અને દીનની જે મોટાઈ છે તે અખત્યાર કરો અને દુનિયાની મોટાઈ તમો ન લીઓ, બીજાઓને મોટાઈ આપો, જેથી બીજાઓ પણ દીનના કામમાં મદદ આપે. ઈમામ ખુદાવંદ છે તે બાતુની મદદ આપે છે અને જાહેરી મદદ આપવી તે જમાતનું કામ છે. તમોને મુશ્કીલી થશે અને તમો જમાત એકદિલ ન હશો તો એક બીજાને કેમ મદદ કરી શકશો ? તમો બેદિલ છો. જે અંદરની કસૂર છે, એટલે દિલની છે એ અમો જાણીએ છીએ. તે હમણાં અમો કાંઈપણ કહેતા નથી, તે કસૂર શેતાનની છે, માટે શેતાનની બાજી ન ખાઓ. અમો ઈરાનથી ચાલીને આવ્યા અને તમોને આ દીનનો રસ્તો દેખાડ્યો, ત્યારે ઈમાન ઘણું જ મજબૂત રાખો. આ વખતે ઈમાન ઘણું મજબૂત રાખો તો ખુદાવંદ ઘણાજ રાજી થાય.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓને ફરમાવ્યું કે :

જે અસલ પાયો મૌલાનું લશ્કર છે તે તમો છો અને પોતાના દિલને ચોકસી કર્યા પછી જ્યારે તમો અમારી હુઝુરમાં આવો છો ત્યારે એમ જણાય છે કે, તમોએ અમારી બેયત ડબલ કરી. ફરમાવ્યું કે આવું કામ કર્યા પછી એમ ન બને કે બેયત તોડી નાખો અને ખરાબ રસ્તો લીઓ, અંવું ન થાય. ફરમાવ્યું કે તમો એવા સાચા થાઓ જે ફિરસ્તા જેવા થાઓ. ફરમાવ્યું કે અમો એવો ખ્યાલ નથી કરતા કે એક, બે, દસ, વીસ, પચાસ, અમો તો એમ ઈચ્છીએ છીએ કે તમારામાંથી બસો માણસો ફિરસ્તા જેવા થાય. ફરમાવ્યું કે હમણાં અમો દેખીએ છીએ કે તમારી મહોબ્બત ઘણી છે. આવી રીતે ચોકસી કરો, જેઓ હિંમત કરે છે તેઓ દરજજે પહોંચે છે. એમ ન સમજો કે નથી પહોંચતા. દિવસે દિવસે એવી મહેનત કરો જે એ જગ્યાએ પહોંચો. અમો દુઆ કરીએ છીએ જે ઊંચે ચડો, મીસાલ ફિરસ્તાના દરજજે પહોંચો. ફરમાવ્યું કે તમારામાં નૂર પેદા ન થાય તો અમારી તકસીર નથી. તમો ખરાબ રસ્તે ચાલશો, જે કામ કરવું જોઈએ તે કામ

નહીં કરશો, તો રોશનાઈ નહીં થશે. જ્યારે એવા કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે જે તલવાર મારવામાં આવે તો પણ ખબર ન પડે. ફરમાવ્યું કે એ જ કામ પર ધ્યાન આપવું જોઈએ, ત્યારે બહારનો કાંઈપણ ખ્યાલ કરવો ન જોઈએ. ઓરડામાં બેઠો હોય અને માણસો આવતા હોય, અવાજ થાય, બોલતો હોય, તો પણ કાંઈ ન સાંભળો, મીસાલ માણસનો મુડદો પડ્યો હોય એ પ્રમાણે જોઈએ. દિવસના ચોવીસ કલાક છે તેમાં બે કલાક પેલી દુનિયામાં હોય, બાકી બાવીસ કલાક આ દુનિયામાં હો. ખાનાવાદાન.

ફરમાવ્યું કે તમો અહીં ભેગા થયા છો તેથી અમો ઘણા ખુશી થયા છીએ. તમારો દરજજો ચડતો રહે ને (૪-૧) ફીરસ્તાઓના દરજજે ચડતા જાઓ. આ દુનિયામાં જ્યાં (૪) (NC) સુધી હયાત છો ત્યાં સુધી ફીરસ્તાઓની હદના થાઓ, પણ મુવા બાદ ફીરસ્તાથી ઉપર જાઓ. મોટા કામવાળાઓની હસ્તબોશી કબૂલ ફરમાવીએ છીએ. બાજી શેતાનની ન ખાજે. શેતાન હઝાર તરેહના છે, જે ઈન્સાન પછવાડે રહે છે. જે આ માણસ કંઈ રીતનો છે, ત્યારે તેને એવી રીતથી પકડે છે. ત્યારે તમોએ બાજી કદી પણ ખાવી ન જોઈએ. ફરમાવ્યું જે ઈન્સાનને શેતાન હઝાર તરેહની બાજી આપે છે, દીનના સાચા હોય છે તે બાજીમાં નથી આવતા. ખાનાવાદાન.



કલકત્તા,

૧૩-૧-૧૯૦૫.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં
ફરમાવ્યું કે :

તમો બધી જમાત દીનના ફૂલ છો, એવી રીતે ચાલો
જે બીજા માણસો અથવા જમાત અથવા હરકોઈ જુએ
તો તમોને ફીરસ્તા કહે. હવે ફીરસ્તા થવાનું શું કારણ છે?
જે તેઓના એવા કામ હોય જે તેઓથી કોઈ પણ વખતે
ખરાબ કામ ન થાય. મોટું કામ કરીને ખરાબ કામ કરે તો
બમણું કે તમાણું પાપ થાય, કેમ કે તમારા હાથમાં દરેક અંપૂર્ણ
ચીઝ છે. નૂર તમારા દિલમાં છે, માટે નૂર તમારા દિલમાં Throne
હોવા છતાં ખરાબ કામ કરો એજ ઘણું ખરાબ છે. તમારા
દિલમાં ખરાબ ખ્યાલ આવે તે ઘણું પાપ છે. એમ ન
કરવું કે એક બે વર્ષ ઈબાદત કરે અને પછી ઓછી કરે તે
બસ નથી. ઈન્સાન મહેનત કરે. આગળ વધે ને ફીરસ્તા
જેવા થાય. તમો મોમન છો, ઈમાની છો, પણ મગરૂર ન
થવું. રાજી થવું. એવો ખ્યાલ કરો જે સારા થયા તે બસ
છે. એમ ન સમજવું જે ઉપર ચડી ગયા તો બસ. મિસાલ
એક દાદર ચડ્યા એટલે દિલમાં એમ ન સમજશો કે અમે
ચડી ગયા, બસ છે, તો તમો નીચે ઉતરી જશો. પણ
પગથિયે પગથિયે માથે ચડો, તેની આ હદ નથી, લા હદ

૧૪
allah ni


(જેની હદ નથી એ) છે. હંમેશા ઊંચે ચઢવું, નિચે ન ઉતરવું. હસદ, મગરૂરી ઘણી ખરાબ છે, પોતપોતામાં હસદ કરવી એ ઘણું ખરાબ છે. ઈન્શાઅલ્લાહ સારા થજો મોહબ્બતથી વરતજો, જ્યાં સુધી પોતપોતામાં સારા હશે તો ઈમાન સારું થશે, હસદ મેલ દિલમાં લાવશો તો ઈમાન ઓછું થઈ જશે અને દિલમાં શક આવશે, તો નાનો શેતાન શરૂઆત કરશે. પહેલે નાનો શેતાન ભૂલ ખવડાવશે પછી આસ્તે આસ્તે દીનમાંથી કાઢીને બેઈમાન કરે છે અને બેઈન કરી નાખે છે. બે ત્રણ કામ કોઈ વખતે કરજો નહીં.

૧. પોતપોતામાં બેદિલ ન થવું.

૨. મોમન થઈને હસદ ન કરવી.

૩. મોમન થઈ દગો ન કરો.

શા માટે કે જો હસદ કરશો તો દીન ધરમ પણ આસ્તે આસ્તે જશે. ખાનામાં ઈબાદત વખતે બરાબર હાઝર થાવ. હમેશાં સારા થાઓ. બાદ ફરમાવ્યું કે તમારામાં એવી ચોકસાઈ કરો જે એક ભાઈ થાઓ. એકદિલ થઈ ત્રણ જણા ચાલો. એક વખત એકસો માણસ એક તરફ હતા, તેમાં બે માણસોએ એકસો માણસોને હટાવી દીધા, તેમાંથી એક દાનેશમંદે કહ્યું જે બે એકદિલ હતા અને એકસો ના દિલ જુદા જુદા હતા તેથી તેઓને હટાવી દીધા. તમો ત્રણ જણા એકદિલથી ચાલો તો ત્રીસ લાખ જેવા છો, ખાનાવાદાન.



મુંબઈ,

૨૭-૭-૧૯૦૫.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓને ફરમાવ્યું કે :

તમો લોકો જે મોટા કામવાળા છો તે દીનના એક મજબૂત પાયા (સમાન) છો. જેમ એક બંગલાનો નીચેનો પાયો હોય છે તેમ તમારો રૂહ છે, તે બંગલાની નીચેનો મજબૂત પાયો છે. તમે અમારા બગીચાના એક ગુલાબના ફૂલ છો. તમો મોટું કામ કરો છો ત્યારે તમો જાણો કે બંગલાની અંદર દાખલ થયા છો. મારી હકૂમત (સત્તા) જે શખ્સ બંગલાની અંદર દાખલ થાય છે તેના પર છે. જે શખ્સ બંગલાની બહાર છે તેના પર નથી. ત્યારે તમારી ફરજ છે કે જે પ્રમાણે અમો તમોને હુકમ ફરમાવીએ અને કોઈપણ વખતે મદદ માંગીએ ત્યારે તમોએ બરાબર તેના માથે અમલ કરવો જોઈએ, કારણ કે તમો અમારું લશ્કર છો. જ્યારે તમો શેતાનની બાજી ખાશો અને બરાબર નહી ચાલશો ત્યારે અમો બીજા સારા ક્યાંથી ગોતવા જઈએ ? જ્યારે તમો મોટું કામ કરો છો ત્યારે તમારો માલ, ધન, માથું, બધું તમારા પોતાની હકૂમતમાંથી અમારા હુકમમાં સોંપો છો, ત્યારે તમારા પર ફરજ છે જે અમારા ફરમાન પર બરાબર અમલ કરવો. અગર તમોને જે કામ યાને

બોજો આપવામાં આવે છે તે અગર તમો બોજો ઉપાડી નહી શકો. જો કામ નહી કરશો તો તમારું ઈમાન એકદમ ચાલ્યું જશે.

તમો જે છો તે એક ઘોડાની મીસાલ ન થાઓ. જેમ કે એક ઘોડા માથે એકદમ ભારે બોજો નાખ્યો હોય તો ઘોડો ઉપાડી ન શકવાના કારણે તેના પરથી થોડો બોજો હલકો કરવામાં આવે છે, તમો એવા ન થાઓ. તમો એક મરદ પહેલવાન જેવા થાઓ, કે ગમે તેટલો પારા બોજો હોય છતાં શુરાપણથી પહાડ માથે પારા ચાલ્યા જાઓ.

ઈલમ, ઈમાન, અને આમીલ ^{Ghadat} સારા હોય તો મોમન ઘણોજ જલદીથી સાતમા આસમાન માથે પહોંચી શકે છે. તમોને જે આપવામાં આવે છે તે જો તમો બરાબર નહીં કરશો તો તમે એક ઈન્સાનને કોલ દીધેલો તોડી નાખો તે મીસાલ છે.

ઈન્શાઅલ્લાહ તમો બરાબર એકદિલી રાખીને તમારું કામ શુરાપણથી બજાવો તો તમારું ઈમાન કોઈ વખતે ઓછું થવાનું નથી..... ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓને બૈતુલખ્યાલમાં રાતના બાર વાગે પધારીને ફરમાવ્યું કે :

તમોને અગાઉ દરવાજા બંધ કરવા માટે ફરમાવ્યું હતું તો તમો એ દરવાજા બંધ કરો છો ? જમાતે જવાબ દીધો 'હા ખુદાવંદ' તલવાર રાખવાનું કહ્યું હતું જેથી કોઈ આવી ન શકે, જો આવે તો તેને તલવારથી કાપી નાખવું, તો તે તલવાર રાખી છે ? જમાતે જવાબ દીધો 'હા ખુદાવંદ' બીજું ફરમાવ્યું જે બત્તી ઝાંખી કરવા ફરમાવ્યું હતું તો તે કરો છો ? જવાબ દીધો 'હા ખુદાવંદ' ફરમાવ્યું જે શર્મની વાત છે. અમોએ તમોને ક્યા દરવાજા બંધ કરવાનું ફરમાવ્યું હતું, દરવાજા એ બંધ કરો જે તમારું મન ભટકે છે તે દિલના દરવાજા બંધ કરો અને બંહારના ખ્યાલ આવવા ન દીઓ. જો કોઈ આવે તેને તલવારથી યાને યાઅલીના જાપથી કાપી નાખવો, યાને તલવાર એ છે. ફરમાવ્યું જે બત્તી ઝાંખી કરો છો તે આ બત્તી બળે છે તે નહીં પણ જે નીંદરની બત્તી છે એ ઝાંખી કરો, જેથી કરીને દિલની બત્તી રોશન થાય. દરવાજા બંધ કરશો તો ગરમી થશે, માણસને તલવારથી કાપી નાખશો તો નુકશાન થશે,

પણ જે અમોએ દેખાડેલ છે એ પ્રમાણે કરો.

ફરમાવ્યું કે આટલી બધી જમાતે મોટું કામ કર્યું છે, કોઈને કેટલા વરસ થયા છે પણ હજી સુધી તમારામાંથી કોઈપણ નૂરને નથી પહોંચ્યો. તમારામાંથી જે કોઈ પહોંચ્યો હોય તો ઊભો થાય. ત્યારે કોઈપણ ઊભું થયું નહીં. ફરમાવ્યું કે આ જાપ નૂરને જેવાનો છે છતાં તમો જેઈ ન શકો ત્યારે તમોને એમ લાગશે કે સાહેબ ખોટા છે જે રૂપિયા પોણોસો લઈ જાય છે, તેથી બહેતર છે તમો હવેથી મોટા કામની બાબતમાં બોધ ન કરો. તેના કરતાં મહેમાની કરો તો અમો તેનો બદલો આ દુનિયામાં ને પેલી દુનિયામાં આપશું પણ આ બોધ ન કરો.

ફરમાવ્યું કે ઈબાદત પૂરેપૂરી કરો. ત્રણ કલાક બેઠક કરો, તેમાં પણ તમારું ધ્યાન ક્યાંય પણ ન જાય. બીજું ફરમાવ્યું કે તમોને કોઈ આ ગાલ પર તમારો મારે તો બીજો ગાલ ધરો. એવી રીતે સાહેબે પોતે કરી દેખાડ્યું.

ફરમાવ્યું કે તમારાથી ઈમામ હુસેનને કતલ કરવાવાળા હઝાર દરજ્જે સારા હતા, કારણ તેઓએ ઈમામત જે ચીજ છે તેને શહીદ કરેલ નહીં પણ તમો જે મારા ફરમાન પ્રમાણે નથી ચાલતા તે મારી ઈમામતને ઓછી કરો છો ચાને કતલ કરો છો, ત્યારે તમો પણ તેઓ કરતાં ખરાબ

છો. વળી ફરમાવ્યું કે તમે લોકો એમ સમજો છો કે સાહેબની નોકરી ન કરવી. ત્યારે અમારી ખિજમત અને નોકરી નહી કરો ત્યારે અમારા મુરીદ શેના ? અસલ નોકરીમાં રહેતા હતા ત્યારે આ મોટા કામનો ભેદ મળતો હતો અને જલદી પહોંચી જતા હતા પણ હમણાં તો તમો આમ કરો છો તો કેમ પહોંચી શકશો ? વળી ફરમાવ્યું કે તમો લોકો જ્યારે તમારા કપડાં ખરાબ થાય ત્યારે સુઈ રહો છો, બંદગી નથી કરતા અને કહો છો કે કપડાં ખરાબ છે જેથી શું કરીએ, તો બંદગી શરીરની નથી રૂહની બંદગી છે, રૂહ હંમેશાં પાક ચીજ છે માટે બંદગી ચુકવી નહીં. નાહવાનું ન બની શકે તો સવારે નાહવું પણ બંદગી મુકવી નહીં. તમારું શરીર, હાથ, પગ, વગેરે દુખતા હોય તો આવીને, ટેકીને યા ગમે તેમ બેસવું, પણ ઈબાદત ન મુકવી.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે જંગબારની જમાતના કેટલાક અમલદારીઓ અને મોખાસાની જમાતના અમલદારીઓને ખાનગી મુલાકાત દરમ્યાન ફરમાવ્યું કે :

તમો પોતાના પેટને કબ્રસ્તાન ન બનાવો. જેમ કે કબ્રસ્તાનમાં મરેલાં માણસોનાં મુડદા દાટે છે, તેમ તમો તમારા પેટમાં જાનવરનો માંસ નાખો છો યાને ખાઓ છો, તેથી તમારા પેટને જાનવરનું કબ્રસ્તાન બનાવો છો, માટે તમારા પેટને કબ્રસ્તાન ન બનાવો. વળી માંસ ખાવાથી માણસનું દિલ સખત થાય છે. જેમ કેટલાક માંસ ખાવાવાળા જાનવરોનું દિલ સખત રહે છે, એટલુંજ નહી પણ તેઓનો ચહેરો પણ ખોફનાક હોય છે, તેમ માંસ ખાવાથી તમારું દિલ પણ કઠણ થશે. માંસ ખાવા માટે અમો તમોને એકદમ મનાઈ નથી કરતા, કારણ કે તમો એકદમ માંસ ખાવાનું બંધ કરશો તો તમારું દિલ હિંદુ જેવું થઈ જશે. માટે માંસ ખાઓ પણ થોડું ખાઓ. એટલે કે મહિનામાં એક વખત અથવા પંદર દિવસે એક વખત, ઘણામાં ઘણું ખાઓ તો હફતામાં એક વખત ખાઓ. બાકી દૂધ, ઘી, ખુબ ખાઓ. બટાટા, ભાજી, વગેરે ખાઓ,

અનાજ ખાઓ, કોઈ વખતે સારી તાજી મચ્છી મળે તો ખાઓ પણ સુકી સડેલી કે વાસી મચ્છી બીલકુલ ન ખાવી. બીજું ફરમાવ્યું કે તમો ચા ઘણી સ્ટ્રોંગ કરી પીઓ છો તે પણ ઝેર માફક છે, એટલે કે તમારા શરીરનું લોહી બાળી નાખે છે. હમણાં જે તમો મારી પાસે બેઠા છો, તેમાં કેટલાક આસરે ચાળીસ વરસથી નાની ઉંમરના છો, પણ તેના ચહેરા તો જુઓ, વારસ મામદભાઈ રેમતુલા હેમાણી, ગુલામહુસેનભાઈ ભલુ કુરજી વગેરે તરફ હાથ કરીને બતાવ્યું કે એક જઈફ જેવા અને ફીકા પડી ગયેલા દેખાય છે, તેનું કારણ એ છે કે તમો ચા ઘણી અને સ્ટ્રોંગ પીઓ છો, જેથી તમારા શરીરનું લોહી સુકાઈ જાય છે, તેના સાથે રૂહાની શક્તિ પણ નાશ થાય છે અને આખરે હેવાનિયતમાં ઉતરી જશો. ચા રૂપી ઝેરથી તમોને એટલી બધી નુકશાની થશે. ત્યારે જુમા ભગત કરાંચીવાળાએ અરજ રાખી કે જાગરણમાં, મિજલસમાં નિંદર ટાળવા માટે ચા થાય છે તેનું શું કરવું? ત્યારે ફરમાવ્યું કે એક નાની પ્યાલી કાવાની પીવી તેનાથી નિંદરા ટળી જશે, તેથી કાંઈ નુકશાન નથી પણ ચા ઘણી અને સ્ટ્રોંગ પીવાથી તમારા શરીરને નુકશાની છે, તેથી અમો તમોને મના કરીએ છીએ. જેમ પીરોએ ગીનાનમાં બીડી, તમાકુની મનાઈ કરી છે. તેનો મતલબ શું છે? તમાકું વાપરવાથી માણસને ફેફસાનું દરદ લાગુ પડે છે, તેથી રૂહાની શક્તિમાં

ખલલ પહોંચે છે અને માણસ પોતે હેવાનિયતમાં ઉતરી જાય છે. પીરોએ ગીનાનમાં ફરમાવ્યું છે અને સખ્ત મનાઈ કરી છે જે તમાકું વાપરશો તો જહન્નમમાં જશો. અગર જે પીરોએ સાધારણ રીતે કહીયું હોત કે તમાકું વાપરવાથી તમારા શરીરને નુકશાની છે તો દુનિયાના લોકો બેદરકાર થઈ તમાકુંનો વધારે વપરાશ કરત, તેથી જ પીરોએ સખ્ત મનાઈ કરી છે. ન કે તમાકું વાપરવાવાળા શખ્સ જહન્નમના અધિકારી થાય છે. અર્થાત તમાકું વાપરવાથી પહેલા ફેફસાનું દરદ થશે. તેથી રૂહાની શક્તિ ચાલી જશે અને હેવાન જેવા બની જશો, તેમ અમો તમોને ઘણી સ્ટ્રોંગ ચા પીવાની મનાઈ કરીએ છીએ, તેનો પણ મતલબ આ છે. જે ચા પીવાથી પહેલાં શરીરમાં લોહી સૂકાઈ જાય છે અને ગુરદાનો રોગ લાગુ પડે છે, તેનાથી રૂહાની શક્તિ ચાલી જાય છે અને માણસ હેવાનીમાં ઉતરી જાય છે, તેથી ચા પીવાની તમોને અટકાયત કરીએ છીએ. જેકે અમો તમોને ચા પીવાની સહંતર મનાઈ નથી કરતા પણ જે તમોને ચા પીવી હોય તો આ રીતે કરો : પાણીને ગરમ જોશ કરી તેમા ચાના પત્તા નાખી એક મિનિટ પછી ચૂલા માથેથી ઉતારી મુકવી. તે પણ એવી રીતે જે અરઘો કપ ચાનો તેમાં અરઘો કપ દૂધ મિલાવી, ખાંડ નાખીને પીવી. તે પણ દિવસમાં એક કપ પીવી. વધારે ન પીવી કારણ કે જાજી ને સ્ટ્રોંગ ચા ઝેર મિસાલ છે.

બીજું ફરમાવ્યું કે મોમનની નિશાની એ છે કે હંમેશાં મૌલાની સેવા ચાકરી બજાવે. પણ મોમનની એ નિશાની નથી જે અમલદારી પદ ધારણ કરીને તેમાં પોતાની મોટાઈ સમજીને મગરૂર થાય, એ નિશાની નથી. મોમન એ છે જે મૌલાની સેવા ચાકરી કરે. જેમ કે હઝરત મુર્તઝાઅલીની હુઝુરમાં મલેક ઉશ્તર કરીને એક મોમન હતો. તે હંમેશાં હઝરત અલીની સેવા ચાકરી કરતો હતો. એક દિવસ હઝરત અલીએ તેને કાંઈપણ કામ કલ્પ્યું ન હતું તેટલા માટે મલેક ઉશ્તરે બેઠા બેઠા દિલમાં વિચાર કર્યો કે આજે નવરો બેઠો છું તે સારું નથી, માટે કોઈ કામ શોધી કાઢું. એવા વિચારથી બહાર નિકળીને તેણે જોયું તો જે રસ્તેથી હઝરત મૌલા અલી ઘણું કરીને આવજાવ કરતા હતાં એ રસ્તો કોળી લોક સાફ કરતા હતાં, ત્યારે પોતે પણ એ કોળી લોકો સાથે શામિલ થઈ રસ્તો સાફ કરવા લાગ્યો. એટલામાં હઝરત અલી એ રસ્તેથી આવીયા અને જોયું તો મલેક ઉશ્તર કોળી લોક સાથે સામેલ થઈને રસ્તો સાફ કરે છે, ત્યારે હઝરત અલીએ ફરમાવ્યું કે હે મલેક ઉશ્તર તું તો મારો માનીતો અને શૂરો સરદાર છો, ત્યારે તું કોળી લોકો સાથે રહીને આ રસ્તો સાફ કરવાનું કામ શા માટે કરે છે? ત્યારે મલેક ઉશ્તરે અરજ કરી કે ‘યા મૌલા આજ રોજ તમો ખુદાવંદે મને કાંઈપણ કામ ફરમાવ્યું નહીં તેથી નવરા બેઠા બેઠા મને કાંઈ ન પસંદ પડિયું અને કોઈ કામ

ન સુજિયું ત્યારે આપનો રસ્તો સાફ કરવામાં મશગૂલ થઈ રહ્યો છું.’ ત્યારે મુર્તઝાઅલી મલેક ઉશ્તર પર ઘણાં ઘણાં ખુશી થયા. તેમ તમો પણ ચોક્કસ સમજો જે મોમનની નિશાની આ છે જે મૌલાની ખિદમત કરવી, પણ અમલદારી પદ ધારણ કરી તેમાં મગરૂર થાય જે હું મોટો છું અને જમાતનો ઉપરી છું વગેરે ખ્યાલોથી મગરૂર થાય એ નિશાની મોમનની નથી. જો કે તમે અમલદારી છો પણ તમારી ફર્ઝ શું છે એ બરાબર સમજો અને એ ફરજ કોશીશથી મહેનત લઈને અદા કરો. ટૂંકમાં તમારી ફરજ એ છે જે સરકાર સાહેબની ને જમાતની ખિજમત કરવી અને દીન ઘરમનો વધારો થાય તેમજ જમાતમાં એક સંપી કાયમ રહે તેના માટે બનતા ઈલાજ કરવા, તેથી અમે તમારી ઉપર ઘણાં ઘણાં રાજી થઈશું, આ નિશાની મોમનની છે.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓને ફરમાવ્યું કે :

તમારું દિલ છે તે નરમ યાને બાઈ માણસનું દિલ છે એવું કંરો અને બાઈઓને ફરમાવ્યું કે તમારું દિલ છે તે ઠીક છે. પણ તમારી અક્કલ બરાબર નથી, કારણ કે તમો લોકો કોઈપણ માણસની બાઝી બાઈ શકો છો. પણ જો તમારી અક્કલ મરદ જેવી હશે તો તમે કોઈની બાજી બાઈ નહીં શકશો. બાદ ફરમાવ્યું કે તમે લોક ઈબાદત બંદગીની અંદર બિલકુલ મગરૂર ન થાઓ. કારણ જે ભગત જુમાભાઈનો દાખલો આપી ભગત જુમાભાઈને ફરમાવ્યું કે તારી બાબત કહી બતાવ. ત્યારે જુમા ભગતે કહ્યું કે મેં જ્યારે મુંબઈમાં મુલાકાત લીધી ત્યારે હું મારો દરજ્જો સાહેબની બરાબર સમજતો હતો અને હું પોતાને ઈબાદતની અંદર સહી ખુદા સમજતો હતો તેથી ફરમાવ્યું કે ઈબાદતની અંદર બિલકુલ મગરૂર ન થવું. બાદ ફરમાવ્યું કે તમો આ ચીજ લીઓ છો અને તેના ઉપર પ્યાર નથી રાખતા એ ઠીક નથી. ફરમાવ્યું કે તમારું એક નાનું બચ્ચું હોય તેને તમે જ્યારે તેડો છો ત્યારે પ્રથમ તમારે દિલની અંદર ઉલટ આવે છે પછી તમારું મન તેના માથે જાય છે પછી તમારી આંખોની અંદર રહેમ છૂટે છે, ત્યારે તમે તેને હાથમાં લઈને

પ્યાર કરો છો. જેમ એક માણસ આંધળો હોય તેનું બચ્ચું તેના પાસે આવે છે ત્યારે તેને પણ દિલમાં ઉલટ પેદા થાય છે અને તેનું મન તેના માથે જાય છે ત્યારે તેને પ્યાર કરીને તેડે છે, તેમ આ ચીજ પણ એવી છે. બાદ ફરમાવ્યું કે અમોને તમે પોતાના દિલમાં હાઝર દેખજો. તમે જ્યારે જમાતખાનામાં આવો ત્યારે પણ અમોને હાઝર દેખજો. ખાલી પીલી વાતો ન કરો, અને કાન દઈને સાંભળો.

બાદ ફરમાવ્યું કે તમારું શરીર છે તે એક ગામ મીસાલ છે અને તેની અંદર તમારો રૂહ તથા પંચભુ અને મન વગેરે છે. જેમ એક ગામ હોય અને તેની અંદર બે રાજા ભાગીદાર હોય તેમાંથી એકની મરજી હોય તો એ ગામથી આસતે આસતે પોતાની વસતીને તાબે કરીને પછી ગુપ્ત રીતે વસતી વધારીને પોતાનું જુદું ગામ બનાવતો જાય. તેમ તમે પણ શરીરની અંદર પોતાના રૂહને સાતમા આસમાન પર એટલે ઊંચે લઈ જવા માટે સાંકળની કડીઓ એક એક કરીને બનાવતા જાઓ, તો તે સાંકળ છેક સાતમા આસમાન સુધી જશે. તેથી કરીને તમો એ સાંકળના આધારે ઊંચે ચડી શકશો. માટે તમારા દિલમાં એ સાંકળ રોજ એક (આમ કહીને ઘણી સલામત દાતારે પોતાના બંને હાથ મુબારક સાથે પોતાની આંગળીઓ મીલાવીને આંકડા કરીને ફરમાવ્યું કે) આ પ્રમાણે રોજ રોજ સાંકળ બનાવવાનું ચાલું રાખો તો ઊંચે ચડી શકશો, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

દુનિયામાં દરેક ઈન્સાનને ઘણાં રસ્તાઓ છે તેમાંથી કેટલાક જીસમાની છે અને કેટલાક જીસમાની ને રૂહાની ભેળસેળવાળા છે, જેમ ઈન્સાનમાં બે મોટી રગો છે તેમ પાણી પણ બે છે. દાખલા તરીકે જીસમાની રસ્તા આ પ્રમાણે છે. પહેલા ઈન્સાનને ભુખ લાગે છે તેની ફરિયાદ મગજ પર થાય છે તેથી દિલમાં ખાવાનો ઈરાદો થાય છે, ત્યારે ઈન્સાન જઈને ખાય છે. આવી રીતે ચાર કડીઓની એક સાંકળ થઈ. (૧) ભુખ (૨) મગજ પર ફરિયાદ (૩) દિલનો ઈરાદો (૪) ખોરાક. આમ ચાર કડીઓની સાંકળ થઈ. આવા રસ્તા જીસમાની સમજવા. હવે રૂહાની અને જીસમાની ભેળસેળવાળા રસ્તા આ પ્રમાણે છે.

જુઓ પ્રથમ ઈન્સાન બચ્ચાં અથવા ઓરતને જુએ છે પછી તેની જાણ મગજ પર થાય છે, તેથી તેને પ્યારનો ઈરાદો દિલમાં થાય છે, પછી તેના પર પ્યાર કરે છે, એ પણ ચાર કડીઓની એક સાંકળ થઈ. (૧)બચ્ચાં અથવા

ઓરતને જોવું (૨), તેની જાણ મગજ પર થવી (૩)
 દિલમાં પ્યારનો ઈરાદો થવો (૪) પ્યાર કરવો. આ ચાર
 કડીઓની પણ એક સાંકળ થઈ. આ રસ્તો રૂહાની અને
 જીસમાનીનો ભેળસેળવાળો છે, કારણ કે તેમાં બે બાબતો
 રૂહાની અને બે બાબતો જીસમાની છે. માટે એવા રસ્તાને
 રૂહાની અને જીસમાની ભેળસેળવાળો સમજવો. હવે આ
 બે રસ્તા દાખલા તરીકે કલ્યાં પણ એવા રસ્તા ઘણાં છે.
 જો ટાઈમ હોય તો દસ વીસ દાખલાઓ તમને સમજાવું,
 પણ હમણાં ટાઈમ નથી પરંતુ ખાત્રીપૂર્વક સમજવું કે
 આવા રસ્તા ઈન્સાન પસાર કરે છે, પરંતુ જીસમાની રસ્તાથી
 કોઈ અસલમાં નથી થઈ શકતો. એવા રસ્તામાં રહીને
 જ્યારે મરે છે તીયારે બીજો જીસમ પકડે છે.
 એ જીસમ હેવાનીનો લીએ છે. તેમાં રૂહાનીની કંઈ પણ
 સમજ હોતી નથી. બિલકુલ ચોક્સ જીસમાની હોય છે;
 માટે ખાસ કરીને જે રૂહાનીના રસ્તા છે તે પ્રમાણે વર્તો.
 અલહમ્દુલિલ્લાહ એ રસ્તો તમોને મળ્યો છે.
 તમોને દેખાડીઓ છે પણ ચાર કડીઓની સાંકળ
 મિસાલ છે. પહેલે તમે જુદાઈનો ખ્યાલ કરો કે અમે
 પોતાના અસલથી જુદા થયા છીએ, બીજું એવા
 ખ્યાલને હંમેશાં મગજમાં ભરી રાખો, એટલે કે ભૂલી ન
 જવું અને હંમેશાં યાદ રાખવું અને વાસલ થવાની દિલમાં
 યાદના કરો, તે માસુક સાથે મિલાપ થાય એવી

રીતે ચાર કડીઓની એક સાંકળ થઈ. (૧) જુદાઈનો ફિરાક (૨) એ મગજમાં ભરી રાખવું (૩) દિલમાં તેની ચાહના કરવી (૪) વાસલ થવું. આ ચાર કડીઓની જે સાંકળ બની તે રસ્તો રૂહાનીનો છે. માટે તેનો હંમેશાં ખ્યાલ કરતાં રહેજો, કે જેથી તમે તમારા અસલ મકાન પર પહોંચો.

હવે ખ્યાલ કરો કે તમારું અસલ શું છે ? કોઈ કહે છે મારું અસલ આદમથી છે; તો આદમથી તમારા જીસમ થયા છે પણ તેની પહેલા તમારું અસલ 'આલમ ઝરે' અર્થાત ઝીણા રજકણ જેવા (ઝરા) પરંતુ તે ઝરા તમે 'આલમ ઝરે'ના વખતથી થયા છો, પણ તેની પહેલા શું હતા ? ઝરાથી પણ ઝીણાં (લા) અર્થાત નિરાકાર કહેવાય છે તે હતા. તો ત્યાંથી તમે ઉતરતાં ઉતરતાં આ જીસમની અંદર બંધાણા છો. વાસતે જીસમથી પોતાને છૂટો કરો તો પોતાના અસલમાં વાસલ થાઓ. પરંતુ એ કંઈ એમ નથી કે બાઈડી બચ્યાં ત્યાગી દીઓ, અથવા તો ભૂખે મરીને દેહ છોડો, અથવા છૂરીથી કાપી નાખવું અથવા કોઈ પણ રીતે પોતાને મારી નાખવું. આ રીતે કોઈ છૂટો થવાનો નથી. આમ કરવાથી ઉલટા વધારે દુઃખમાં પડશો, કારણ કે જ્યાં સુધી તમે જુગતીસર દેહથી છૂટા નહીં થશો તે દરમ્યાન દેહ પડશે તો ફરી બીજા જીસમ પકડવા

પડશે. પરંતુ જુગતી વગર તમારી દેહને ખાકમાં મીલાવી દેશો તો ઉલટા વધારે દુઃખ પેદા થશે અર્થાત ખાકમાં કીડા પડશે, એ કીડામાં તમારા રૂહનો સમાવેશ થશે, માટે તમને જે આ માનખા જન્મ મળ્યો છે તેના આધારે રહીને તમે પોતાના રૂહનો રસ્તો તૈયાર કરો એટલે દુનિયામાં પોતાના બાલબચ્ચાંઓને સંભાળો અને ખાધા ખોરાકી પણ રીતસર ખાઓ કેમકે તમે કોઈપણ રીતે તે છોડી નહીં શકશો. તેમાં રહીને પોતાના રૂહને જીસમથી જુદો કરશો, તે એવી રીતે કે જે રસ્તો તમે અપ્તીયાર કર્યો છે તો એના પર બરાબર ખ્યાલ રાખો અને ખરાબીઓ છે તે દૂર કરો. ખાસ કરીને મોટી ખરાબી એ છે કે એક બીજની દુશ્મની કરવી. માટે કોઈની પણ દુશ્મની ન કરો કોઈની હસદ ન કરો, કોઈની સાથે કીન્નો ન રાખો, હરામનો માલ અને હરામખોરીથી દૂર રહો વગેરે જે બેફરમાનીના કામો છે તે મુકી દીઓ અને ઈબાદતમાં ખ્યાલ પૂરો રાખો અને વખતો વખત સુધારા વધારા હાંસલ કરતા જાઓ જેથી તમારો રૂહ દેહથી જુદો થાય અને પોતાના અસલમાં અર્થાત નૂરમાં મળી જાય, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓને મિજલસ હૉલમાં પધારી ફરમાવ્યું કે :

દુઆ ફરમાવીએ છીએ, ખાનાવાદાન ઘણું સારું કર્યું છે, અને આનાથી બીજું કાંઈપણ સારું નથી. જે કર્યું છે તે સારું છે. જે કોઈ મિજલસમાં દાખલ થયા છે, એ મિજલસનો ફાયદો થાય તે લેજો, ભૂલી ન જાઓ. પોતાના દિલને ચોક્કસ કરો. શેતાનની બાજી ન ખાઓ. ફરમાવ્યું કે શેતાન હાઝર તરેહથી બાજી આપે છે, જે કોઈ મોમન માણસ આગળ વધે છે તેને ફરેબથી શક પેદા થાય છે. ફરમાવ્યું કે શેતાન છે તે શાહીનો કાળો દાગ લગાવે છે, તે આ પાણીમાં ધોઈ સાફ કરો, ધોઈને સાફ નહિ કરો તો તમારા દિલની આંખો આંધળી થઈ જશે. તમારું દિલ પણ આંધળું થઈ જશે. જે મોમન છો તે પાછા મગરૂરી ન કરો જે અમે મોમન છીએ, એવી મોટાઈ ન કરો. ફરમાવ્યું કે તમારું ઈમાન છે તે સારું કરો. સાફ રાખજો. તમને બાજી આપવાવાળા ઘણા છે. તમો બાજી ખાઓ નહીં. જે તમારું દિલ છે તેની અંદર મેલ પેદા થાય છે તે ધોઈ નહિ નાખો તો મેલ વધતો જશે અને અંધારું પેદા થશે.

તમારું દિલ છે, તે જન છે પણ એવી હઝારો જન હોય તો
 પણ કુરબાન કરો. ફરમાવ્યું કે તમારામાં યુવાન બચ્ચાં
 વિગેરે જલદી બાજી ખાઈ જાય છે. એમ થવું ન જોઈએ
 પોતાને ચોક્કસ કરો કે બાજી ન ખાવી, પોતાનો મિજાજ
 સંભાળવો અને ધંધો કરવો વાજબ છે. મિજાજ ન સંભાળો
 તો ઘણું ખરાબ છે. ધંધો કરવો, પેટ ભરવું. ઘણી સરકારનું
 ખાનું વહેવાર સંભાળો, તો તેમાં તમારો મિજાજ દીન
 દુનિયામાં દુરસ્ત રહે. મોમનની આ નિશાનીઓ છે. છ
 કલાક આરામથી સુવું જોઈએ. આ મોમનની નિશાની છે.
 જો આમ નહિ વરતો તો ઉમર જલદી જશે. માટે જનને
 સંભાળવું વાજબ છે. અમો એમ નથી કહેતા કે બેજ કલાક
 સુઓ. એ તો ગુનાહ છે. છ કલાક સુવું બધાને માટે
 વાજબ છે. ચાર પાંચ કલાક રાતના, એકાદ કલાક દિવસના
 આરામ કરવો, તો દુનિયાનો ધંધો પણ કરી શકો છો.
 જાગરાણના દિવસે રાતના દસ વાગે આવતા રહો, થાળ
 સુફરો મિજલસ વિગેરે કરજો. અગિયારવાગે ખલાસ
 થાયે પછી જેને સુવું હોય તે સુવે તેને છુટ છે, પાછા ત્રણ,
 સાડા ત્રણ વાગે હાઝર થાય. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઇમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

ખાનાવાદાન તમે જે આ મહેમાની કરી છે તેનો બદલો ખુદાવંદ તમને બંને દુનિયામાં આપશે. તમે જે મોટા કામમાં દાખલ થયા છો તે કિલ્લામાં દાખલ છો. આ જે દીનના કિલ્લા છે તે તમે પોતે છો. દીન છે તે થંભ છે, મોમનનું દિલ છે તે મિસાલ થંભ છે. તમે બધા કિલ્લાની અંદર છો. જે એક વખત પણ ખરાબ કામ કરશો, શેતાનની બાજી ખાશો તો ઘણું નુકશાન છે; શું કારણ, જે તમે કિલ્લાની અંદર છો. તમારો પગ લપશે તો તમે પડી જશો. આ કિલ્લાની અંદરની બાજીને, પૂલસીરાત કહે છે જે આ કિલ્લાની દિવાલ છે, ત્યાં જવું ઘણું આસાન છે પણ તમો લપશી જાઓ ને જમીન પર પડી જાઓ તો બીજી વખતે જવું ઘણું મુશ્કિલ છે. તમે આ કામ કરો છો અને ઇબાદત નહિ કરો અથવા શક લાવશો તો તમારું ઇમાન ધીમે ધીમે ચાલ્યું જશે અને રહેશે નહિ. હિંમત કરીને પોતાના દિલને હાઝર નથી કરતો તેનું ઇમાન નહિ રહેશે, શા માટે જે દિલની અંદર ચિરાગ છે યાને નૂરનો દિવો છે, તે દિવો અમો અમારા હાથથી દીવાસળી વડે

બાળીયે છીએ યાને એ બત્તીને રોશન કરીએ છીએ અને તમે છો તે એ બત્તીને તોડી નાખો છો કે તે બત્તી પડે તો આખી જનને બાળી નાખે છે.

ફરમાવ્યું કે આના બદલામાં તમે પોતાના દિલને તકલીફ આપો. તે નૂરની બત્તીને સદા રોશન રાખો અને તે બત્તીને તમે નહિ સંભાળશો તો પડી જશે. તો રોશનાઈને બદલે નુકશાની થશે. ખુદા ન કરે ને તમે બિમાર હો અને કામ ન થાય તો પણ ખરાબ છે, શા માટે એવો હુકમ નથી જે બિલકુલ સુઓજ નહિ. તમારું શરીર નાપાક હોય તો બંદગી જે છે તે રૂહની છે. રૂહ તો પાક છે. કેદખાનામાં, દરિયામાં, ગમે તેમ થાય પણ જ્યાં સુધી જન છે ત્યાં સુધી આ કામને મુકજો નહિ. ફરમાવ્યું કે આ કામ ઘણું આસાન કરવાનું છે પણ એક શરત છે, ચોવીસ કલાકની અંદર એક બે કલાક તમે જો ખ્યાલ કરશો, તે પણ બીજે ઠેકાણે ન જજો, બંદગી પર બેસો ને ખ્યાલ બીજે ઠેકાણે હોય તો ફાયદો નહિ થાય યાને એ વખતે તમારો ખ્યાલ એજ બંદગીમાં હોય તો ફાયદો થાય. તમે પોતાના ખ્યાલને બીજે ઠેકાણે દોડાવો તો નૂર તમારા ઘટમાં કેમ આવીને બેસે ? જો એટલું નથી બનતું તો અમારા પાસે ચીઠ્ઠી કઢાવીને આવો ને ઓછું કરાવો, પણ પોતાના દિલનો જે ખ્યાલ છે તેને મજબૂત કબજે રાખો.

ખુદા ન કરે ને બંગલો તુટી પડે તો પણ તમને

ખબર ન પડે. જેમ હોસ્પિટલમાં એક માણસને દવા સુંઘાવે છે ત્યારે તે બેહોશ થાય છે, એવી રીતે પોતાના ખુદાના ઈશકની મસ્તીમાં હો ત્યારે તમને પણ ખબર ન પડે. ખુદાનો ઈશક યાને જે વખતે ઈબ્રાહિમ હકીકી કરો તે વખતે તમો એવા થઈ જાવ જેમ પયગંબર મએરાજ કરવા ગયા. મએરાજની માફક રૂહને ઊંચે મોકલી દીઓ, તમે એક કલાક મરીને જીવતા થાઓ. મરવું ને જીવતા થવું તમારા હાથમાં છે. તમોને એવો ખ્યાલ થાય જે પેલી દુનિયામાં જવું, તો તમે રૂહને મોકલી શકો છો, પાછો મંગાવી શકો છો. ફરમાવ્યું કે એ સાચું અને ઘણું મુશ્કિલ છે, પણ ધીમે ધીમે કાંઈ મુશ્કિલ નથી. પહેલવાનની માફક તમે જોર કરી નહિ શકો. તમે વજન ઉપાડી નહિ શકો, ઉપાડશો તો મરી જશો, પહેલવાન એટલું મોટું વજન ઉપાડે છે ને પાછો મુકી દીએ છે. બચપણમાં કંઈ ન થાય. આ ખુદાઈ શક્તિ નથી. ત્યારે કેવી રીતે થાય છે ? ફરમાવ્યું કે હંમણાં રોજ અડધો કલાક પોતે કસરત કરે, વરજશ કરે, આખું શરીર કસરત કરે, તો એવી રીતે શરીર શક્તિ હાંસલ કરે છે અને કુવતદાર થાય છે. તમારી પણ આવી રીતે વરજશ યાને કસરત છે. તમે એવો વિચાર કરો કે હું મએરાજ જાઉં તો તે કાંઈ મોટી વાત નથી, પણ તમે નહિ જઈ શકો, કારણ કે તમોએ તાલિમ નથી લીધી. વરજશમાં શું થાય છે ? ખ્યાલ કબજે રાખો તો પછી કામ થાય છે. આ કામ પર જ્યારે તમે બેસો છો ત્યારે બીજા ખ્યાલો

મુકી દીઓ, પરંતુ એજ ખ્યાલ પર રહો. આ બધું પણ તમારાથી ન બને તો ચીકી લઈને હુજુરમાં ઓછું કરાવો. થોડું કરવા માંગો છો એ પણ તમારા હકમાં નુકશાની છે. હું પછી કરીશ એ પણ ઘણું ખરાબ છે ઈમાન ચાલ્યું જશે તેમાં કાંઈ શક નથી. એક મિનિટ પાકી બંદગી બે વરસની કાચી બંદગી કરતાં વધારે છે.

એકજ જગ્યા ઉપર બેસો તો વધારે સારું છે. એક મિનિટ પાકી ઈબાદત ઘણી સારી છે. બે વરસની કાચી ઈબાદત કરતા એક મિનિટ પાકી ઈબાદત ઘણી સારી છે. તમે જે આ કામમાં દાખલ થયા છો અને ઈબાદત નથી કરતા તે આ કામમાં દાખલ નથી તેના કરતાં પણ તમે નીચે ચાલ્યા જશો. ફરમાવ્યું કે દીનનું જે કામ છે તે પાંચ આંગળીઓ માફક કરવું જોઈએ. દીનના કામમાં કોઈ નાનું મોટું નથી દીનના કામમાં તસ્બીના મણીઆ બધા સરખા છે. મોટા એ છે કે જેઓના કામ તથા આમાલ સારા છે, તેઓ નેક છે. ફરમાવ્યું કે આ જે મોટું કામ તમે કરો છો ત્યારે અમો તમને દીનનો દરવાજો દેખાડીએ છીએ. હવે એ દરવાજો ખુલ્લો છે. તમે અંદર આવો અથવા તો બહાર રહો એ તમારી મરજી. જે આ કામ લઈને ઈબાદત નથી કરતો તેનું ઈમાન આસ્તે આસ્તે ચાલ્યું જાય છે. રાતના બાર વાગ્યા પછી આફતાબ (સૂરજ) ઊગે ત્યાં સુધી તમે જેટલી ઈબાદત કરો તે બધી ઊંચે ચડે છે, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

પહેલા તમારા રૂહને પાક કરો. જે રસ્તાની તમને માહિતગારી છે, તે રસ્તા ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. આવી રીતે રૂહ પાક થશે. તમારા મરણ બાદ તમારો રૂહ પાક થવાથી બીજી દુનિયામાં જશે. કારણ કે રૂહ ખુદાનું નૂર છે. જેમ એક આગનું તણખલું મોટા ઢગલામાં નાખીએ તો એક થઈ જાય. તમારો રૂહ મળી જશે તે નૂર એક થઈ જશે એ પણ મરવા વખતે, પણ હૈયાતીમાં નહિ. જીસ્મને ન જોવું પરંતુ રૂહનો ખ્યાલ કરો. શુકર છે કે તમે બધા રૂહાની રસ્તા પર છો, જે રસ્તો તમોને મળ્યો છે. રૂહના રસ્તા ઉપર ચાલવા માટે શરીરની પણ જરૂરત છે.

ફરમાવ્યું કે દરેક બિમારીની દવા જુદી જુદી જોઈએ. તેમ ઈબાદતનું કામ પણ તેવુંજ છે અમો દરેકને જુદા જુદા આપીએ છીએ, અને અમો દેખીએ છીએ કે, કોનામાં કેટલી શક્તિ છે, તે પ્રમાણે કામ આપીએ છીએ. એક પહેલવાન જેવો હોય તેને વધારે કામ આપીએ છીએ, જઈફને થોડું આપીએ છીએ. પહેલવાનનો બોજો જઈફ

માથે નાખીએ તો તે ઉપાડી શકશે નહિ. તમે બધા મારી હુઝુરમાં આવો છો અને કામ કરવામાં કસુર કરો છો, તે ન કરવી અને ભુલી ન જવું. તમને જે કામ આપીએ છીએ તે સખત નથી. તે બચ્ચું પણ કરી શકે એવું થોડું કામ આપીએ છીએ, તેમાં કાંઈપણ કસુર કરવી ન જોઈએ.

ફરમાવ્યું કે તસ્બીહ કાઠી નખાવવામાં આવી છે તેનું કારણ કે ધ્યાન અખંડ રહે. એ તસ્બીથી શું અડચણ છે? ગણવામાં અને દાણાઓમાં ધ્યાન જાય છે, તેના માટે મુકાવી દીધેલ છે. અગર તમારાથી ન બને તો આ કામ શા માટે લીધું છે? આ બોજો લઈને નહીં પાળશો તો નુકસાનીમાં જશો. તમે કામ કરીને સૂઈ જાવ તો વધારે નુકશાની છે અને પોતાની જિંદગીનો વખત નકામો ગુમાવો છો, તેના કરતા તમો હમણાં જાહેરની બંદગી કરો અને રૂહાનીની બંદગી બીજા અવતારમાં કરજો. જાહેરની બંદગી પણ સારી છે. તેનાથી પાકાઈ થાય છે. તમને કેટલો ઓછો બોજો છે? અગાઉના વખતમાં કામ ઘણું સખત હતું, ચાર કલાક, છ કલાક, આઠ કલાક બંદગીનું કામ કરવામાં આવતું હતું. હમણાં બે કલાક છે, પીર સદરદીન સોળ કલાક બેસીને બંદગી કરતા હતા, બે કલાક સુતા હતા, ચાર કલાક વાએઝ ગીનાનની નસિહત કરતા હતા. હમણાં તમારા ઉપર શું બોજો છે? કેટલો બધો ઓછો છે?

આટલું થોડું કામ પણ કરવામાં ના હિંમત થશો તો તમને
નુકશાની છે. બે કલાક બંદગી કરવી ઘણીજ આસાન છે.
ઇમાનદાર છે તેને અમો ઔલાદ તરીકે બોલાવીએ છીએ,
તે જીસમની ઔલાદ નહીં પણ રૂહની ઔલાદ તરીકે
બોલાવીએ છીએ. રૂહ છે તે બદન કરતાં કેટલી વધારે
શક્તિ ધરાવે છે, તેવી રીતે રૂહનો પ્યાર અમારો તમારા પર
વધારે છે, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે પુનાના ચરોડાના બંગલામાં કરાંચી, બગીચા, તથા ગુઆદરની જમાતોને બોલાવીને ફરમાવ્યું કે :

બધા ખાસ પંજેભાઈઓ છે ? કોઈ વગર કામનો નથી? ફરમાવ્યું કે તમને જોઈને મારી આંખો રોશન થાય છે. તમે મારા રૂહાની ફરજંદો છો અને તમે ઘણા ઈમાનદાર છો અને ઈમાન છે તે નૂર છે, ત્યારે તમે નૂરને જુઓ તો અસલ મકાન પર પહોંચો.

ફરમાવ્યું કે તમો તમારા દિલમાં ઘણી મગરૂરી રાખો છો જે અમો મોટા દરજ્જા પર ચઢીઆ છીએ; પણ આ ખ્યાલ એક નાદાનીના મિસાલ છે. જો તમે એક હઝારનું કામ કરો પણ તેનો મતલબ ન સમજો તો તેમાંથી શું ફાયદો થશે ? આ કામ શા માટે છે તેનો મતલબ ન સમજો તો જેમ ગધેડાને હીરો મળે અને ગળામાં બાંધે, ગધેડો તેની કદર નથી સમજી શકતો, એ મિસાલ તમારી છે, માટે હમણાં તમે કોણ છો અને ક્યાં જશો અને તે કેવી રીતે જશો તેનો મતલબ સમજો. તમે પોતાને ઓળખો

તો તમને અસલની ખબર પડે. તમારામાંથી કેટલાક
 માણસો બારસોનું કામ કરે છે પણ તેનો મતલબ સમજી
 શકતા નથી. કેટલાકો તેનાથી વધારે કરે છે પણ તેનો
 મતલબ સમજી શકતા નથી. માટે જ્યાં સુધી મતલબ
 નથી સમજતા ત્યાં સુધી નાદાન છે. તમો ખાલી નામ
 મોટું ન કરો, અસલને ઓળખો જે ઈન્સાન આ વાતો પર
 ખ્યાલ નથી રાખતો, તો તમે ચોક્કસ સમજો કે એ બરાબર
 શેતાન મલઉન છે, જે ખુદાના ફરમાન ઉપર નથી ચાલતો.
 માટે તમે યાદ રાખો કે જ્યાં સુધી તમને એટલી કમતાકાતી
 હોય જે બેથી ચાર જણાં તમને પકડીને મિજલસમાં લઈ
 આવે ત્યાં સુધી તમને આવવું વાજબ છે. ઘણી અફસોસની
 વાત છે, તમારી ખુદા એવી હાલત ન કરે તો ઘણું સારું.
 કેમ કે એવા વખતે ઈન્સાનથી ઈબ્નાદત થઈ શકતી નથી,
 માટે તમને જે કામ મળ્યું છે તે કોઈ વખતે નુકશાનીમાં ન
 જાઓ તેના માટે છે, ન કે ઈબ્નાદતમાં કાહેલી કરવાના માટે
 છે. માટે જે શખ્સ ઈબ્નાદતમાં કાહેલી કરે છે તો સમજજો
 કે તેના ઈમાનમાં હરકત થાય છે. આ તો પહેલી નિશાની
 છે, માટે તમે જવાંમરદ થાઓ. જે પોતાના વખત પર
 મિજલસમાં આવી પહોંચો, પણ કેટલાક દૂર રહે છે તેને
 મુશકેલી થાય તો પણ જરૂર છે જે મિજલસની બે રાતો
 આવવું વાજબ છે, એ ન ભૂલજો. તો તમને દીનની તથા
 તમારા રૂહની ખબર પડે. જો તમે રૂહાની ઈલમ નહિ

સાંભળો તો તમને ખબર કેમ પડશે? માટે બે રાતો આવવું વાજબ છે.

બાદ ઘણી સલામત દાતારે પૂછીયું કે મિજલસમાં કેટલા જણા વાએઝ કરે છે ? ત્યારે કહેવામાં આવીયું કે સાહેબ પહેલાં બે જણા હતા, હવે એક જણ કરે છે. ત્યારે હાઝર ઈમામે ફરમાવ્યું 'શું વધારે જણા વાએઝ નથી કરતા ? વાએઝ કરવી સઘળા ઉપર વાજબ છે.'

બાદ ઘણી સલામત દાતારે મુખીને પૂછીયું કે તમારી તરફ કેટલા જણા વાએઝ કરે છે ? જવાબ આપીયો કે 'ખુદાવંદ આગળ કરાંચીમાંથી બે જણા આવતા હતા, હવે નથી આવતા.' ત્યારે હાઝર ઈમામે ફરમાવ્યું કે તમે કેમ મોકલતા નથી ? પછી ફરમાવ્યું કે તમે તમારામાંથી વાએઝ કરવાનો બંદોબસ્ત કરો તો ઘણું સારું છે કેમકે બગીચામાં વધારે ઈલમ છે, માટે જરૂર બંદોબસ્ત કરો.

બાદ ફરમાવ્યું કે ફીરસ્તા થવું અને તેના કરતાં પણ આલા (ઉત્તમ) થવું એ ઈન્સાનના પોતાના હાથમાં છે. એટલે સુધી કે ખુદાની નજદીક થઈ શકે છે. આ બાબતો ઈન્સાનના પોતાના હાથમાં છે. માટે હિંમત રાખશો તો પહોંચશો. અલહમ્દુલિલ્લાહ જે હાલ થોડા દિવસ થયા રંગુનમાં રૂહાની ઈલમનો જુસ્સો પેદા થયો છે. માટે જેમ

હિંમત કરશો તેમ વધશો; પણ તમે આલા દરજે પહોંચવાની
ઉમેદ રાખો તો પહોંચશો. પછી બધાની દસ્તબોશી કબુલ
ફરમાવી અને ફરમાવ્યું જે અમો કરાંચી આવવા માટે ખુશી
હતા, હવે ઈન્શાઅલ્લાહ અમને ફુરસદ થશે તો આવતે
વરસે પધારીશું, ખાનાવાદાન. બધાને ફરમાવ્યું કે જેના
કામ થઈ ગયા હોય તે જલદી પોતાને દેશ જાય.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે પુનાની વાડીમાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે જે તમારી હૈયાતી બાદ જોવા માંગો છો તે તમારી હૈયાતીમાં જુઓ. તેમાં એવીશરત છે કે પહેલા એક મિનિટ, પછી બીજે દિવસે બે મિનિટ પણ એક ધ્યાનથી બેસો. એમ નહીં કે તમે હઝાર ઠેકાણે તમારું ચિત્ત રાખો. અમે જે શબ્દ આપીએ છીએ તે ઉપર તમારી સુરતી એકદિલથી બરાબર રાખતા જાઓ. તે એવી રીતે જે પહેલાં એક મિનિટ, બીજે દિવસે બે મિનિટ એમ દરરોજ એક એક મિનિટ વધારતા જાઓ. એમ પણ જો બની ન શકે તો ચાર દિવસ સુધી એક મિનિટ રાખો. એમ ચાર ચાર દિવસે એક એક મિનિટ વધારતા જાઓ અને પછી અડધો કલાક અને એમ આસ્તે આસ્તે કરી કલાક બેસો તો ઈ-શાઅલ્લાહ છ મહિનામાં બલ્કે ત્રણ મહિનામાં તમે હૈયાતીમાં જ તથા હૈયાતી બાદ તમે જે પણ મોઢેથી માંગો તે દેખી શકશો. બલ્કે ત્રણ દિવસ મરી જાઓ યાને બરાબર એક સુરતીથી જેટલી તાકાત તમારામાં છે તેટલી શબ્દ પર આપો અને બરાબર એકધ્યાનથી બેસો તો ફક્ત ત્રણ દિવસની અંદર જોઈ શકશો. પણ તમે બેસી

શકશો નહીં, બલકે અડધો કલાક પણ એકધ્યાનથી તમે બેસી શકશો નહીં. જે તમે પોતાની હેયાતી બાદ જોશો તે તમે તમારી હેયાતીમાં જુઓ, તેમાં શરત એ છે કે પહેલાં તો તમે મરી જાઓ, યાને એવી રીતે જે પહેલે એક મિનિટ, પછી બે મિનિટ, ત્રીજે દિવસે ત્રણ મિનિટ, ચોથે દિવસે ચાર મિનિટ, પાંચમે દિવસે પાંચ મિનિટ, પણ એવી રીતે બેસો કે તમારો ખ્યાલ આ દુનિયાના કોઈ ઠેકાણે કોઈ પણ કામ ઉપર અગર ક્યાં પણ જવો ન જોઈએ અને અમો તમને જે શબ્દ આપીએ છીએ તે ઉપર બરાબર બેસો. તે એવી રીતે જે પહેલે દિવસે ઉપર પ્રમાણે, તેમ તેમ આસ્તે આસ્તે કરીને દરરોજ એક મિનિટ વધારતા જાઓ, તેમ દરરોજ એક એક મિનિટ ન બને તો ચાર ચાર દિવસે મિનિટ વધારતા જાઓ. પણ એમ સમજો કે મરી ગયા હો તેમ બેસો અને શબ્દ ઉપર સુરતી રાખીને પછી આસ્તે આસ્તે અડધો કલાક અને પછી એક કલાક અને એમ વધારીને બરાબર બે કલાક બેસો તો ઈન્શાઅલ્લાહ જે તમે જોવા માંગશો તે છ મહિનાં બલકે ત્રણ મહિનામાં તમે હેયાતીમાંજ જોઈ શકશો; પણ તમે અડધો કલાક પણ બેસી નહીં શકો. તમારામાં હિંમત નથી, નહિ તો અમો જે બોલ આપીએ છીએ તેના માથે તમારી જેટલી તાકાત છે તે બરાબર આપો તો ઈન્શાઅલ્લાહ જરૂર જોઈ શકશો; માટે બરાબર બેસવા શીખો અને બેસો, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મઝગાંવની વાડીનાં મોટા હોલમાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

ખરો દીન જે ઈસ્માઈલી છે તે તમારા પાસે છે. ફરમાવ્યું કે તમોને એક કલાક ઝીકરનો છે અને કેટલાઓને બે કલાક ઝીકરના છે તે બરાબર એકધ્યાનથી બેસવું જોઈએ અને તે વખતે અહીં તહીંના ખ્યાલ રાખવા ન જોઈએ. જ્યાં સુધી તમારો ખ્યાલ અહીં તહીં હશે તો આગળ વધી શકશો નહીં. તમે એક પગથિયા પર, બે પગથિયા પર, ત્રણ પગથિયા પર, ચાર પગથિયા પર, પાંચમાં પગથિયા પર છો. તમે એવો ખ્યાલ મ કરજો કે બસ આટલે સુધી છે, પણ એમ સમજજો કે ઘણાં પગથિયા છે, એમ સમજીને એકધ્યાનથી બે કલાક સુધી તમને મરી જવું જોઈએ અને અહીં તહીંના ખ્યાલ ન હોય એવી રીતે એક ધ્યાનથી બેસવું જોઈએ. પહેલા તમે એક મિનિટ એકધ્યાનથી અહીં તહીંના ખ્યાલ ન હોય એવી રીતથી, પછી બે મિનિટ, પછી ત્રણ મિનિટ, પછી ચાર મિનિટ, પછી પાંચ મિનિટ. એવી રીતે તમે પોતાની આદત રાખો. હમણાં એક શપ્સ હોય, ઘણો ઈમાની હોય પણ એ શપ્સને તમે ધ્યાનથી

બે કલાક બેસવા માટે કહો તો તે શખ્સ કદી પણ બેસી નહીં શકે, કારણ કે તેની આદત નથી. જ્યાં સુધી તેની આદત નથી થઈ ત્યાં સુધી તે શખ્સ બેસી નહિ શકશે. પહેલા એક મિનિટ એકધ્યાનથી અહીં તહીંના ખ્યાલ ન હોય એવી રીતે ચારથી પાંચ દિવસ સુધી, પછી બે મિનિટ, એજ પ્રમાણે પછી ત્રણ મિનિટ, પછી ચાર મિનિટ, એ પ્રમાણે પોતાની આદત રાખો. જે તમે આવી રીતે આદત રાખશો તો તમે આગળ વધી શકશો. તમે આવી રીતે પોતાનું ધ્યાન પગથિયા પર મજબૂત બરાબર ચોક્કસ કરશો તો તમે તે પગથિયા પરથી ટપીને ચાર પાંચ પગથિયા પર ચડી જશો. આવી રીતે તમે હમેશાં કવાયત લેશો તો તમે આગળ વધી શકશો.

ફરમાવ્યું કે કેટલાકનું ઝીકર જબાનથી ને કેટલાક દિલથી કરે છે પરંતુ જે તેમનો ખ્યાલ બહાર રહે છે ત્યારે અંદરનો તાર તૂટી પડે છે અને તમને નુકશાન થાય છે. નુકશાન એ છે કે તમે આગળ વધી શકશો નહીં. ફરમાવ્યું કે તમને જે જોવાનું છે તે કેટલાક મરી ગયા બાદ જોશે પણ તમે પોતાની હૈયાતીમાં મરીને જોઈ શકો છો. તમને જવાહીર આપવામાં આવ્યું છે તેને તમે પેટીમાં અથવા તિજોરીમાં બંધ કરીને રાખશો યાને વાપરશો નહીં તો તમને કાંઈ પણ ફાયદો થશે નહીં, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

ખરા દીને ઈસમાઈલી તમે છો. અને બાતુની દીને ઈસમાઈલી તમારા પાસે છે. ફરમાવ્યું કે એક અથવા બે કલાક ઝીકરના છે તેમાં બરાબર ધ્યાન રાખી બેસવું જોઈએ. પહેલા તમે એક મિનિટ એક ધ્યાનથી આજુબાજુના ખ્યાલ ન હોય એવી રીતે બેસો. પછી બે મિનિટ, પછી ત્રણ મિનિટ, પછી ચાર મિનિટ, પછી પાંચ મિનિટ તમે ચીવટ રાખો. આવી રીતે ચારથી પાંચ દિવસ સુધી એક મિનિટ પછી ચારથી પાંચ દિવસ સુધી બે મિનિટ, એવી રીતે વધારતા જાઓ. આવી રીતે હમેશાં તમે કવાયત લેશો તો આગળ વધી શકશો.

ફરમાવ્યું કે આગળ માટે તમે બીલકુલ ખ્યાલ ન કરજો અને આગળ બહેસ્ત મળશે કે દોજખ, તેના માટે બિલકુલ ખ્યાલ ન કરજો. કારણ કે દોજખ અને બહેસ્ત બધું મારા હાથમાં છે, બંદગીના ટાઈમ પર સારા કે નરસા ખ્યાલ બિલકુલ દિલમાં ન લાવજો, કે આ કામ કરવા હું બેઠો છું કે બીજી સારી આશા પર ધ્યાન ન દેજો. બંદગીના

વખતે ઝીકર ઉપર ધ્યાન દેવું. બીજા કેટલાકો છે તે અમારા ચહેરા પર ધ્યાન પહોંચાડે છે તે ઠીક નથી, તે વખતે બિલકુલ એવી નજર પહોંચાડવી ન જોઈએ, ફક્ત ઝીકરમાંજ ધ્યાન સાંસ-ઉસાંસ ઉપર પહોંચાડવું.

ફરમાવ્યું કે જે કિંમતી ચીજ અમો ઇનાયત કરીએ છીએ તે અમારું નામ છે જો ખરા ચકિનથી મારા ફરમાન પ્રમાણે ચાલો તો જે નામ તમને આપ્યું છે તે રૂપ તમે જોઈ શકશો. અમને આ સ્વરૂપમાં જોઈ શકશો નહીં, જે નામ હશે એજ સ્વરૂપ હશે. દરેક નામના દરેક સ્વરૂપ જુદા છે. તમે એવો ખ્યાલ ન કરો જે તે રૂહાનીમાં અમને આ સ્વરૂપમાં જોઈ શકશો એ તો બનવાનું નથી.

ફરમાવ્યું કે કોઈ એમ કહે છે જે આજે મેં સાહેબને સ્વપનામાં દીઠા અને મને આમ ફરમાવ્યું તે બરાબર નથી. જો એમ હોય તો નિશાની શું? અને અમો કોઈના સ્વપનામાં જતા નથી.

તમારું ચકિન સાચું છે અને તમને દવા આપવાની જરૂર નથી. જેવી રીતે એક બિમાર હોય અને ઘરે ડૉક્ટરને તેડાવ્યો હોય અને ડૉક્ટર આવીને જુએ કે કાંઈ બિમારી નથી તો તેને દવા આપવાની જરૂર નથી, એ મિસાલ તમે છો. તમારું ઇમાન તમે મજબૂત રાખજો.

ફરમાવ્યું કે તમે અમારી ઉપર પૂરે પૂરો વિશ્વાસ રાખજો; મનમાં જરા પણ શક લાવજો નહીં. ફરમાન બરદારી ઉપર બરાબર મુસ્તકીમ રહેજો. દોજખ અને બહેસ્ત મારા હાથમાં છે, તમને ઝીકરનો એક કલાક છે અને કેટલાકોને બે કલાક ઝીકરના છે તેમાં બરાબર ધ્યાનથી બેસવું જોઈએ અને આજુબાજુના ખ્યાલ રાખવા જોઈએ નહિ. જ્યાં સુધી તમારા ખ્યાલ આજુબાજુ જશે ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં. કોઈ એક પગથી પર, કોઈ બે પગથિયા પર, કોઈ ત્રણ પગથિયા પર, કોઈ ચાર પગથિયા પર, કોઈ પાંચ પગથિયા પર છે માટે તમે એવો ખ્યાલ ન કરજો કે હવે બસ છે, પણ એમ સમજવું કે ઘણાં પગથિયા છે, એવું સમજીને એક ધ્યાનથી બે કલાક સુધી મરી જવું જોઈએ અને આજુબાજુના ખ્યાલ ન હોય એવી રીતે એક ખ્યાલથી બેસવું જોઈએ. અગર એક શખ્સ ઘણો જ ઈમાની હોય પણ શરૂઆતમાં એ શખ્સને તમે એકધ્યાનથી બે કલાક બેસવાનું કહો તો તે શખ્સ ક્યારે પણ બેસી શકશે નહીં.

પહેલા એક મિનિટ આજુબાજુના ખ્યાલ વગર ચારથી પાંચ દિવસ સુધી બેસવું, પછી બે મિનિટ, પછી ત્રણ મિનિટ, પછી ચાર મિનિટ, આ પ્રમાણે તમો આદત રાખો, જો આવી રીતે આદત રાખશો તો આગળ વધી શકશો.

તમે એવી રીતે તમારું ધ્યાન પગથી પર મજબૂત રાખીને ચોક્કસ કરશો તો એ પગથી પરથી ઠેક ભારીને ચાર પાંચ પગથિયા ચઢી જશો.

ફરમાવ્યું કે કેટલાકો ઝીકર જબાનથી અને કેટલાકો દિલથી કરે છે પરંતુ જે તેઓનો ખ્યાલ બહાર હોય તો અંદરનો તાર તૂટી પડે છે અને નુકશાની થાય છે. નુકશાની એ થાય છે જે તમે આગળ વધી શકતા નથી. તમને જે જોવાનું છે તે કેટલાક મરી ગયા પછી જુએ છે પરંતુ તમે તો તમારી હૈયાતીમાં મરીને જોઈ શકો છો. તમને જે જવાહીરાત આપવામાં આવ્યું છે તે જે તમે પેટી અથવા તિજેરીમાં બંધ કરીને રાખશો તો કોઈ પણ ફાયદો થશે નહીં. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે તમારી ઈબાદતના વખતે હંમેશા હાઝર રહેજો અને ઈબાદતના મકાનમાં આવતા જાઓ અને ઈબાદત, ઝીકર કરવું, પણ જો કદાચ બિમારીના લીધે આવી ન શકો તો પોતાના ઘરમાં ઈબાદત કરો, પણ ઈબાદત જરૂર કરવી. ફરમાવ્યું કે બિમાર હો અને ખાટલા પર પડિયા હો અને તમારો સાંસ આવે અને જાય તો પણ ઈબાદત થઈ શકે છે માટે ઈબાદત કરવી. ઈબાદત એવી કરવી જે ખ્યાલ બીજે ઠેકાણે ન જાય. જો તમે એમ કરો અને તેનો ફાયદો ન દેખો એ બનવા જોગ નથી, તે કસૂર તમારી છે, માટે તમે આદત પાડો કે ઈબાદત વખતે રૂહને શરીરમાંથી બહાર કાઢીને ઈબાદત કરો, મિસાલ મુડદા માફક મરી જવું. ઈબાદત એવી કરવી જેમ બીજા કોઈ વાતમાં ખ્યાલ ન રાખવો, આ વરજશ છે, તે એક મિનિટ, બે મિનિટ, ત્રણ મિનિટ, ચાર મિનિટ અને એ પ્રમાણે રૂહની કસરત કરો. પોતાના ખ્યાલને બધી જગ્યાએથી રોકી અને પોતાના શરીરથી પણ રોકીને ફક્ત ઈબાદત કરવી. જો કે એમાં

મહેનત છે જે પોતાના ખ્યાલને તાબામાં રાખવો,
એક કલાક તાબામાં રાખવો, એકદમ એક અથવા અડધો
કલાક રૂહને બહાર મોકલવું તે બનતું નથી પણ આદતથી
બની શકે છે. એક ઠેકાણે ખ્યાલ રાખવાની આદત રફતે
રફતે પાડો. જેમ કલોરોફોર્મ દવા છે જેનાથી માણસ બેહોશ
થઈ જાય છે. એવી રીતે બંદગીમાં પણ બની શકે છે, પણ
તેમાં પોતાના આમાલ નેક કરજો, નેક આમાલ નહિ હશે
તો ફાયદો થશે નહિ, માટે આમાલ સારા જોઈએ અને
જાહેરી કામ પણ કરવા જોઈએ અને જમાતખાનામાં આવવું
જોઈએ પણ જો નહિ આવશો અને બંદગી ટાણે હાઝર
નહિ થશો, તો તે શેતાની છે. એક કોટડીમાં બેસી ખ્યાલ
રોકવાથી કદાચ બની શકે છે અને નિંદ્રામાં પણ ધ્યાન ટકી
શકે છે પણ માણસોના વચમાં બેસીને ધ્યાન ટકાવવું તે
હિંમત છે. કોટડીમાં અથવા નિંદ્રામાં બેસીને ધ્યાન ટકાવી
કસરત કરે, આસ્તે આસ્તે તેના કરતા પણ બેઠક કરીને
રૂહને એક અથવા અરધો કલાક બહાર મોકલી આપવો
તેમાં ફાયદો છે. બાદ આશીષ આપીને સિધાવી ગયા.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

મોટા કામવાળા જેટલા છો તેટલા હમેશાં બંગલીમાં હાજર થજો અને પોતપોતામાં સંપ રાખજો, બીજું શેતાનની બાજી ખાજો નહીં અને દીન ઈસમાઈલી પર મજબૂત રહેજો. શેતાન હઝાર તરેહની બાજી આપે છે તે બાજી ખાજો નહીં. દીનના વાસ્તે અથવા સારા કામના વાસ્તે જન જન્ય તો પણ ભલે પણ પોતાનો દીન ન છોડવો.

ફરમાવ્યું કે તમે દૂર શા માટે જાઓ છો ? જુઓ ઈસમાઈલી અરબ લોકોને કેટલા વરસ સુધી કેદમાં રાખ્યા, ઓછામાં ઓછા નવથી દસ વરસ જમીનમાં કેદ રહ્યા હતા, તો પણ તેઓએ પોતાનો ધરમ છોડ્યો નહીં અને દસ વરસ મુશીબતો સહન કરી અને અહીં આવીને દિદાર કર્યા. તમને જરા તસદી પડે છે તો આવીને અરજ કરો છો કે અમને આ મુશીબત છે. તમને તસદી વધુ હોય તો પણ જેનો ઈશક વધુ હશે તો તેને બીલકુલ ખબર પડશે નહિ. ફરમાવ્યું કે ઝખમ હાથમાં લાગેને જો તમારી હિંમત મજબૂત હશેને ઈશક હશે તો તમારો હાથ કંપશે નહિ અને

ખબર પણ પડશે નહિ. જેમ એક માણસને કલોરોફોમ
સુંઘાવે છે અને બેહોશ થાય છે. તેમ ઈશક હશે ને તકલીફ
હશે તો ખબર પડશે નહીં. ફરમાવ્યું કે તમને બે વરસ
આગમાં દાટી રાખે તો પણ પોતાનો દીન ન છોડવો,
ખાનાવાદાન.

[Faint bleed-through text from the reverse side of the page, likely in Gujarati script.]

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં મોટાખાને ફરમાવ્યું કે :

તમે જે કામ કર્યું છે તે કામ ઝવેરાત જેવું છે, તે છતાં અગર જો તમે ફાયદો ન જોયો હોય તો કામની કસુર નથી; તમારી પોતાની કસુર છે. પહેલે તો ઘણીવાર સુધી આ કામ માથે બેસવાને લીધે ખ્યાલ તૂટી જાય છે અને ખ્યાલ તૂટી જવાથી લાભ થતો નથી. આ કામ જે ઓછું કર્યું તેનો મતલબજ આ છે જે તમારો ખ્યાલ બરાબર રહી શકે; કેમ કે તમે હિંમતવાન અને એવા મજબૂત નથી. તમારામાં અમોને એવા કોઈ દેખાતા નથી કે જેઓ ત્રણ ચાર કલાક બેસી શકે, તેથી એક કલાકના ટાઈમમાં બરાબર ખ્યાલ રાખી કામ કરશો તો ફાયદો જોશો. આ ખ્યાલમાં એટલા મજબૂત રહેવું જોઈએ અને એવો ખ્યાલ રાખવો જોઈએ જે ઓપરેશન કરે, ઝખમ મારે તો પણ ખબર ન પડે. બીજો કોઈ દુનિયાનો ખ્યાલ ન જોઈએ અને પોતાનો ખ્યાલ પણ તૂટે નહિ એવો મજબૂત ખ્યાલ જોઈએ. આ કામ છે તે શરીરમાંથી રૂહને બહાર કાઢીને કરવું જોઈએ. જ્યારે તમે આ કામ બરાબર ધ્યાનથી કરશો ત્યારે તે

વખતે રૂહ શરીરમાંથી છૂટો થઈ બહાર જઈ પાછો
એક કલાક પછી શરીરમાં દાખલ થશે. અગર રૂહ શરીરમાંથી
બહાર નહિ નિકળે તો રૂહ ફાયદો કેમ જોઈ શકશે ?

તમે સાંભળ્યું છે કે પૈગમ્બરને મએરાજ થઈ હતી; તે
આ રીતે મએરાજ ગયા હતા; તેમાં આ વાત પહેલે છે કે
આમાલ બધા સારા હોય. દીન ભાઈઓની દુશ્મની હોય
અથવા ઈમાન બરાબર ન હોય તો તેને ફાયદો થાય નહિ.
તેના કરતાં તો નિંદ્રા કરવી અને પોતાને આરામ દેવો સારું
છે. પોતાને નાહક મહેનતમાં ન નાખવું. જો આમાલ સારા
નહિ હોય તો તેને ફાયદો થશે નહિ; માટે જેનું ઈમાન સારું
છે, દીન ભાઈઓથી મોહબ્બતથી વરતશો, બીજા
આડાઅવળા વિચારો નહિ કરશો તો જ રૂર રૂહાનીને જોશો,
તેમાં જરાય શક નથી. ખનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે બૈતુલખ્યાલની મહેમાની વખતે ફરમાવ્યું કે :

ખાનાવાદાન. તમે ઘણી મહેનત લીધી છે અને જે શખ્સોએ આ કામ કર્યું છે તે ઘણું સારું કામ છે. આ કામ જેણે કર્યું છે અને તે બરાબર બજાવે છે તેના દિલમાં ખુદાનું નૂર છે તેમાં જરાય શક નથી. આ કામ કર્યું છે છતાં નૂર પ્રગટ થતું નથી તેમાં ત્રણ મતલબ છે, જે અમો કામ કરાવતી વખતે ફરમાવીએ છીએ. જે કામ કરવા જોઈએ તે તમે નથી કરતા, તેથી ઈમાન રોશન થતું નથી તેમાં કાંઈ શક નથી. જ્યારે અમો શબ્દ આપીએ છીએ ત્યારે ભલામણ કરીએ છીએ જે આ કામ ન કરો તે તમે કરો છો.

(૧) તમને તમારા આમાલ સુધારવા જોઈએ. આમાલ સુધારશો નહિ તો કામ નહી આવે. (૨) તમે કામ માથે બેસો છો ત્યારે તમારા ખ્યાલ બીજા માથે દોડી જાય છે ત્યારે તાર તુટી જાય છે. જ્યારે કામ માથે બેસો ત્યારે મસ્ત માણસની માફક બેસો, જેને કાપી નાખવામાં આવે

તો પણ ખબર ન પડે, જો તોપ ફૂટે તો પણ શું થયું ? તો પણ તેને ખબર ન પડે. (૩) જેને અમોએ શબ્દ અથવા નક્શ આપ્યો છે તે પગથિયા માફક કામ ન કરે અને ગફલત કરે તો નૂર જોઈ નહિ શકે. તમે ઉચે ચઢો છો અને કહો છો જે પગથિયા છે અને આ નથી થતું, એ સારું નથી. તેથી આ કામ ન લીધું હોય અને નિદ્રા કરો તો સારું જેથી તમારા માથે કરજ ન રહે. એવું કામ લિયો જે સરકારી (અમારા) કરજદાર ન થાઓ, એવી કોશીશ કરવી. જેણે આ કામ કર્યું છે અને જુવાન છે અને શાદી નથી કરી તો તેના માથે અમો ફર્જ નાખીએ છીએ કે તેઓ શાદી કરી લિયે. એક શખ્સે અરજ કરી કે બૈતુલખ્યાલમાં માણસો નથી આવતા. ત્યારે ફરમાવ્યું કે શું કારણ છે ? ત્યારે કહેવામાં આવ્યું કે સીડીના પગથિયા ઘણા છે, તેથી માણસો થાકી પડે છે. બુઢા માણસોએ આ પ્રમાણે કહ્યું ત્યારે ફરમાવ્યું કે હજુ તો સાતમા આસમાન પર ચઢવું છે તે કેમ ચઢી શકશો? એમ ફરમાવીને સાહેબ હસ્યા. બાદ ફરમાવ્યું કે તમે પગથિયા ચઢીને આવશો તો તમારી તબિયત સારી થશે અને તંદુરસ્તી રહેશે, વળી ગિનાન પ્રમાણે ડગલે ડગલે કરોડ જગનનું પુન થાય છે. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે દારેસલામના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે આ મોટા કામમાં દાખલ થયા છો તથા તમો એજ ખ્યાલમાં છો; ખરી રીતે તો હમણાં તમો હકીકતના મુલકમાં દાખલ થયા છો. તમારી મંઝિલ અથવા તો રહેવાનું મકાન દારેસલામ, જંગબાર વિગેરે જગ્યાઓ નથી પણ મએરાજમાં તમારું રહેવાનું રહેઠાણ છે. તમારું શરીર દુનિયાના કામમાં યાને દુનિયા પર હોય પણ તમારો રૂહ છે તે મારી મોહબ્બતમાં હમેશાં મારી અંદર દાખલ હોય.

ફરમાવ્યું કે જ્યાં સુધી આ શરીર દુનિયામાં છે ત્યાં સુધી તમારો રૂહ મારા નૂરી દરિયામાં વાસલ થઈ શકતો નથી, પણ જ્યારે તમારો રૂહ શરીરમાંથી નિકળશે ત્યારે જેમ નદી સમુદ્રમાં મળી જાય છે તેમ મળી જશો યાને મરણ બાદ ત્યાં દાખલ થઈ શકશો. તેટલા માટે તમારા આમાલ તથા કામ સારા હોવા જોઈએ બદનજરથી જોવું નહીં. ફરમાવ્યું કે રૂહની મુલાકાત તે અમલની છે. મોહબ્બત એજ મુલાકાત છે. તમો બદખ્યાલ ન લાવો.

ફરમાવ્યું કે બાઈઓ તથા ભાઈઓ જવાન થાય ત્યારે તરત જ શાદી કરી આપો, જેથી ખ્યાલ બહાર ન જાય.

અમારો જે માલ છે તે તમારા પેટમાં કઢી પણ ન જાય તેની સંભાળ રાખજો. અમારો માલ યાને દશાંદનો પૈસો જે ખાય છે તે મુડદાલ ખાવા બરાબર છે. મારા માલને કોઈ પણ હાથ ન લગાવે યાને માલેવાજબાત કોઈ ખાય નહીં. જે પીર સદરદીને ટેક્સ તરીકે બતાવેલ છે. મોમન થઈને બઢીનું કામ ન કરે, મોમન મોમનને મદદ કરે.

બાદ બાઈઓને ફરમાવ્યું કે કોઈની હસદ તથા નિંદા ન કરવી અને બધા તરફ સારી નજરથી જોવું. ફરમાવ્યું કે તમે પોતાના ઘણીના હુકમમાં રહેજો. દુનિયાની બાબતમાં ઘણી જે હુકમ કરે તે માથે અમલ કરો યાને દરેક બાઈઓ પોતાના ઘણી તરફની ફરજ બજાવે. જો દીનની વિરુધ તે વાત હોય તો કબૂલ કરવી નહીં અને ઘણી પોતાના બચ્ચાંઓને સારા ભાવથી એટલે મોહબ્બતથી જુવે. હમેશાં સાંજના તથા સવારના ખાનામાં હાઝર થવું. અમારા ફરમાન જે છે તે કાનમાંથી કાઢી નાખજો નહીં. બૈતુલખ્યાલમાં હમેશાં આવવું તથા યાદ કરો. જેવી રીતે મિશનરી વાએઝ કરે છે તેવી રીતે અમારા ફરમાન વાંચીને સંભળાવો અને તેની માયના કરો. આ ફરમાન દરેક જમાત માટે છે. બાદ ઘણી દુઆઆશિષ ફરમાવી અને ફરમાવ્યું કે જેવી રીતે આ દુનિયામાં અમારી નજદીકમાં હાઝર છો તેના કરતાં ત્યાં હાઝર દરજે અમારી હુઝુરમાં હાઝર તથા નજદીક હશો. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

હવે અમો કોઈના કામ કરશું નહીં. તમો હવે કોઈની ચિઠ્ઠી કાઢજો નહિ. જેની ચિઠ્ઠી નિકળેલી હશે તેનું કામ કરીશું. જેની ચિઠ્ઠી નહિ નિકળી હશે તેનું કામ તેની ઉમેદ પ્રમાણે વગર પૈસે કબુલ કરીએ છીએ. કોઈ પણ દિલગીર ન થાય. ફરમાવ્યું કે એકવીસ વરસ સુધી અંખડ રાત દિવસ બંદગી કરે અને એક ફળ હાંસલ થાય છે તે અમો તમને બક્ષીએ છીએ અને એવી દુઆ આપીએ છીએ. ફરમાવ્યું કે જેઓએ નૂર જોયું હોય તેઓ ઊભા થાય. તે વખતે અઠીસો માણસો હતા તેમાંથી છ માણસો ઊભા થયા. ફરમાવ્યું કે મને ઘણી અજાયબી થાય છે કે આટલા બધા માણસોમાંથી ફક્ત છ જણા ઊભા થયા. પરંતુ ઓછામાં ઓછા પચીસ ટકા તો નિકળવા જોઈએ અને તમોને નૂર દેખવામાં આવ્યું નહિ તેનું કારણ શું ? તમો અંદર અંદર દુશ્મની કરતા હશો અથવા તો તમારો અમારા પર વિશ્વાસ નહિ હશે, યાને ઈમાનમાં ખામી હશે અથવા તો દશોંદ ખાઈ જતા હશો અથવા તમારા આમાલ સારા નહિ હશે અથવા બદનજર કરતા હશો અથવા ખાને

બંદગીના વખતે હાઝર નહિ થતા હશે. આમાંથી તમારામાં કોઈ પણ જાતનો એબ હશે જેથી કરીને તમો નૂર દેખી શકતા નથી. જો તમારાથી નથી બની શકતું તો તમોએ શાં માટે કામ કર્યું ? અમોએ તમોને આ કામ કરવા માટે બોલાવ્યા નહોતા. એક તો તમે બરાબર આવો નહિં, કદાચ આવો તો બેખ્યાલથી બેસો, તેથી શું ફાયદો થાય ? તેના કરતાં તો બહેતર છે જે તમો નિરાંતે સૂઈ રહો, જેનાથી તમારો મિજાજ તો બરાબર રહે, નાહક અમને પણ મહેનત અને તમને પણ મહેનત, તો પણ અમો તમારા પર રહેમ કરીને એકદમ ઊંચે લઈ જઈએ છીએ, તમો બંદગી કરો ત્યારે દુનિયાનો કંઈ પણ ખ્યાલ ન કરો. બંદગીમાં તમોને ખબર ન પડવી જોઈએ કે તમો જમીન પર છો કે આસમાન માથે, અથવા જંગબારમાં છો કે મુંબઈમાં તે તમોને ખબર પડવી ન જોઈએ, ત્યારે તમે નૂર જોઈ શકશો.

ફરમાવ્યું કે હઝારો માણસો કહે છે જે અમો નૂર દેખીએ છીએ, તમો કેમ નથી જોતા ? જો તમે તમારા શરીરમાં ^{NTK} સોય મારો તો ^{AK} લોહીનું ટીપું બહાર આવવુંજ જોઈએ પણ તમો સોય મારતા નહિ હશે યાને અમો એ કહ્યું છે તે પ્રમાણે ચાલતા નહીં હશે તેથી તમોને નૂર કેમ દેખાય ? તમે એવા જઈફ છો જે તમો હિંદુસ્તાનમાં હો તો

તમોને બક્ષીસ કરવાની છે તે કદી પણ બક્ષીસ કરીએ નહીં, પણ અહીં અમો વારંવાર આવી શકતા નથી તેથી ઘણી મુદ્દતથી અમો આવ્યા છીએ, તેટલા માટે રહેમ કરીને તમોને ઊંચે ચડાવ્યા છે.

ફરમાવ્યું કે હુકમ પ્રમાણે ન ચાલો તો એક હઝાર વરસ સુધી બંદગી કરશો તો પણ મકસુદને પહોંચશો નહીં. ખાનાવાદાન.

૨૭

મુંબઈ,

૭-૩-૧૯૧૫.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે જમાતખાનામાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમો મૌલાનું લશ્કર છો, તમો હમેશાં મારા કિલ્લામાં છો. તમો રૂહને જોવાની તજવીજ કરો. તમે બધાઓની માફક ન ચાલો, પણ એક સરખી રીતે એકતારથી બંદગી કરો, ખાનાવાદાન.

સફેદ રૂહ સાથે મારી હઝુરમાં આવશો. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઇમામે મહેમાનીમાં ફરમાવ્યું કે :

જે અસલ પાયો મૌલાનું લશ્કર છે જે તમો છો અને પોતાના દિલમાં ચોકસી કરો જે તમો અમારી હુઝુરમાં આવો છો ત્યારે એમ જણાય છે કે તમોએ અમારી બૈયત કબુલ કરી. ફરમાવ્યું કે પાછળથી એવું કામ ન થાય કે તમો બૈયત તોડી નાખો અને ખરાબ રસ્તો પકડો. તમે એવા સાચા થાઓ મિસાલ ફિરસ્તા જેવા થાઓ. અમો એવો ખ્યાલ નથી કરતા જે એક, બે, દસ, વીસ, પચાસ., અમે તો એમ માંગીએ છીએ કે તમારામાંથી બસો માણસો ફિરસ્તા જેવા થાય. હમણાં અમો જોઈએ છીએ કે તમારી મહોબ્બત ઘણી છે. એવી રીતે ચોકસી કરો, જેઓ હિંમત કરે છે તે દરજ્જે પહોંચે છે. એવો ખ્યાલ ન કરો કે નથી પહોંચતા દિવસે દિવસે એવી હિંમત કરો જે તે જગ્યા પર પહોંચો. અમો દુઆ કરીએ છીએ કે ઊંચે ચડો, મિસાલ ફિરસ્તાના દરજ્જે પહોંચો.

ફરમાવ્યું કે તમારામાં નૂર પ્રગટ નથી થતું તે અમારી તકસીર નથી તમો ખરાબ રસ્તા પર ચાલો છો અને જે

કામ કરવું જોઈએ તે કામ કરશો નહિં તો રોશની થશે નહીં. જ્યારે એવા કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે જો તલવારથી મારી નાખું તો પણ ખબર ન પડે. એ કામ પર બેસવું જોઈએ ત્યારે બહારનો ખ્યાલ કાંઈ પણ થવો ન જોઈએ. કામમાં બેઠા હો ત્યાં મારાસો આવતા હોય, અવાજ થતો હોય, બોલતા હોય તો પણ કાંઈ ન સાંભળો; મિસાલ મારાસનું મુડદું હોય એ પ્રમાણે જોઈએ. ફરમાવ્યું કે દિવસના ચોવીસ કલાક છે તેમાં બે કલાક પેલી દુનિયામાં હો બાકી બાવીસ કલાક આ દુનિયામાં હો. ખાનાવાદાન.

ફરમાવ્યું કે તમે અહીં ભેળા થયા છો તેથી અમો ઘણા ખુશી થયા છીએ. તમો દરજ્જે ચડતા જાઓ, ફરીસ્તાના દરજ્જે ચડી જાઓ. જ્યાં સુધી આ દુનિયામાં હેયાત છો ત્યાં સુધી ફીરસ્તા જેવા રહો. મરી ગયા પછી ફીરસ્તા કરતાં પણ ઉપર જાઓ. મોટા કામવાળાઓની દસ્તબોશી કબુલ ફરમાવીએ છીએ. શેતાનની બાજી ન ખાઓ. શેતાન હઝાર તરેહના છે, તેથી તમારે બાજી ખાવી ન જોઈએ. ઈન્સાનને શેતાન હઝાર તરેહની બાજી આપે છે, પણ જે દિલના સાચા છે તે બાજીમાં નથી આવતા. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં મોટેપાને ફરમાવ્યું કે :

તમોએ જે મહેમાની કરી છે તેથી તમોને ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ. ખાનાવાદાન. (૧) હમેશાં બૈતુલખ્યાલમાં માણસોની હાઝરી ઘણીજ ઓછી છે, જેથી અમો ઘણાજ દિલગીર છીએ. ચોવીસ કલાકની અંદર એક કલાક હુકમ પ્રમાણે દરેકને ઈબાદત કરવાની ફરજ છે. (૨) લાચારીના કારણે કોઈ પણ રીતે બૈતુલખ્યાલમાં પહોંચી ન શકો તો જે ઠેકાણે તમે હો ત્યાં એક કલાક બંદગી કરવાની ફરજ છે અને એ બહુ જરૂરનું છે. (૩) જેઓ જમાતખાનાની નજદીક હોય તેઓએ હમેશાં જમાતખાનામાં ઈબાદત કરવા માટે હાઝર થવું. દૂર રહેવાવાળાઓને અઠવાડિયામાં એક વખત (આતવાર) યાને સોમવાર રાતની મિજલસમાં હાઝર થવું. હવે અઠવાડિયામાં એક રાત, સોમવાર રાતની મિજલસ ભાઈ માણસો માટે અને જુમેરાત બાઈઓ માટે ઠરાવેલી છે. (૪) દરેક ચાંદરાત પછી પહેલા આતવારના દિવસે ૪ વાગે મિજલસ થાય છે તેમાં મિશનરી વાએઝ કરવા

માટે આવે છે, તેમાં બાઈઓ તથા ભાઈઓને હાઝર થવા માટે આ મિજલસ ચાલુ રાખવી. (૫) જે ઈન્સાન ઈબાદત કરે અને એ જાપ હોય તો એ જાપ મગજ શક્તિથી કોઈ પણ મંઝીલ પર હોય તો એ જાપની બંદગી કરવી તેથી તેને ફાયદો થશે. ઈન્સાને દુનિયામાં દેહી ધારણ કરી છે તો તેને બૈતુલખ્યાલમાં મુખી પાસેથી મહિનામાં એક અથવા બે વખત છાંટો નંખાવવો જેથી અજાણે થતા ગુનાહો દૂર થાય, ઈન્શાઅલ્લાહ તેનો રૂહ પાક થશે.

- (૧) ઈબાદતમાં મશગુલ રહેવું.
- (૨) ઈમાન સાબિત રાખવું.
- (૩) રોવું નહીંજ.
- (૪) ઈબાદતમાં મજબુત રહેવું.
- (૫) હમેશાં આનંદ અને ખુશીમાં રહેવું.

બાંદ દુઆઆશિષ ફરમાવી ફરમાવ્યું, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

અમો તમારી મહેમાની કબુલ ફરમાવીએ છીએ તમોને જોઈને અમો ઘણા રાજી થયા છીએ. અમો તમારા ઉપર ઘણા રાજી છીએ. જો તમે ઈબાદતમાં ઊંચે દરજ્જે ચડશો તો ફનાફીઅલાહની પદવીને નજદીક થશો અને ઉપર પહોંચશો અને બધા કરતાં સારું એ છે કે મિજલસના દિવસે બૈતુલખ્યાલમાં આવી ત્યાં બંદગી ઈબાદત કરો, બાકીના દિવસો તમે બીજી જગ્યાએ બંદગી કરી શકો છો. તમારાથી બને તો મિજલસમાં આવો ત્યારે ત્યાં ઈબાદત કરો તેમાં અહીંતહીંના ખ્યાલ ન કરો. ચોવીસ કલાકમાં ત્રેવીસ કલાક દુનિયાના અને એક કલાક તમે ઈબાદતમાં એવા મશગુલ થાઓ કે જીવતા મરી જાઓ. મોટા કામની ઈબાદત બરાબર એક કલાક કરો વધારેની કાંઈ જરૂર નથી, તેથી એક કલાક બરાબર કરો તો ઘણું છે. આ હાઝર મિજલસમાં તમે જેટલા માણસો એકઠા થયા છો તેમાં અમો એક પણ માણસ એવો નથી જોતા કે જે એક કલાક કરતાં વધુ ઈબાદત કરી શકે, ત્યારે ત્રણ ચાર કલાક

ઇબાદત કરવી મુશ્કીલ છે યાને બનવા જોગ નથી. જેઓ દસ મિનિટ એક ધ્યાનથી ઇબાદત કરી શકે છે તેઓને ચાલીસ વરસની ઇબાદત કરતા વધારે ઇબાદતનો ફાયદો હાંસલ થાય છે અને ચાલીસ વરસ કરતાં વધુ ઇબાદત કબુલ થાય છે. તેથી તમો હમણાં એક કલાક ઇબાદત કરો, તે બરાબર એક ખ્યાલથી તો ઘણું છે. તમો બધાના દિલમાં એક જ ઉમેદ હોવી જોઈએ. તે કેવી રીતે, જેમ રસુલીલ્લાહ મએરાજ પર ગયા હતા અને બદન દુનિયામાં પડ્યું હતું. તેમ તમારો રૂહ આ દુનિયામાંથી આસમાન માથે પહોંચે અને આ બદન દુનિયામાં હોય અને રૂહને ત્યાં પહોંચાડો. ઝીકરનો એક કલાક જે તમારા ઉપર ફર્મ છે તે બરાબર ખ્યાલથી કરશો તો તે કલાકમાં દસ મિનિટ એવી આવશે જે તેની અંદર તમો ફનાફીલ્લાહ થઈ શકશો.

વાએઝ કરવાવાળા બધાઓને વાએઝ કરવાની તક આપવી અને એ વાએઝ રૂહાની કરે તે એવી રીતે કરે જેમ કે સ્કૂલમાં માસ્તર છોકરાઓને કેવી રીતે હોંશિયાર કરે છે, તેમ બધા વાએઝ કરવાવાળા એજ પ્રમાણે વાએઝ કરીને બધાઓને રૂહાનીની બાબતમાં હોંશિયાર કરે. મિશનરી આ મુજબ વાએઝ કરીને બધાને હોંશિયાર કરે એ જરૂરનું છે અને અહીં રૂહાની વાએઝ થવી જોઈએ

અને પછી જ્યારે વાએઝ ખલાસ થાય ત્યારે એક કલાક બરાબર ઈબાદત એક ધ્યાનથી કરવી.

ઘણી સલામત દાતારે પંજેભાઈઓને ફરમાવ્યું કે મુખી હમેશાં ત્રણ વાગે બૈતુલખ્યાલનો દરવાજો ખોલશે, જેની ખુશી હોય તે આવે અને બંદગી કરે, અગર જો કદી ઘરમાં ગરમી હોય, હવા ન હોય, અગર જો બેસવાનું બરાબર ન હોય તો તેને અહીં આવીને બંદગી કરવી સારું છે અગર જેને પોતાના ઘરમાં સગવડ હોય તો ભલે ઈબાદત કરે પણ ઈબાદત ચારથી પાંચ વાગ્યા સુધી એક કલાક જ રૂં કરવી જોઈએ અને મિજલસનો ટાઈમ આગળ બે વાગ્યાનો હતો તે હવે પછી અઢી વાગે ચાલુ કરજો આતવાર અને જુમેરાતના સતાડા જે બાઈઓના દર વર્ષે નવ અને ભાઈ માણસોના વરસમાં સાત કરતા હતા તેના બદલે હવે વરસમાં પાંચ કરજો.

તમે સતાડા નાખો છો પણ તેની માયના સમજતા નથી, સતાડાની માયના એ છે કે તમો સાત દિવસ ગોસ, મછી અને ચાને મુકી આપો અને સાત દિવસ તમારી આંખો પાક રાખો, સાત દિવસ કોઈની ગીબત ન કરો, જૂઠું ન બોલો, સાત દિવસ નોકરના હાથનું પકાવેલું ન ખાઓ અને બાઈ માણસ જે તમારા ઘરના હોય એ પણ પોતે નાહીઘોઈને પકાવી આપે અને તે ખોરાક દશોંદ

કાઢેલો હોય, પારકા ઘરનું ખાવું નહિ જોઈએ. આને સતાડો કહેવાય છે. સતાડા છૂટતી વખતે પણ તમોએ કોઈ પણ જાતનું માંસ ખાવું ન જોઈએ. સતાડાની રાતના બે વાગે બધાઓએ આવવું અને હાઝરી આપવી તસબીનું કામ ખલાસ કરી પછી વાગેઝ, ગિનાનનો મુશાહેદો કરવો અને ચાર વાગે બેઠકમાં બેસવું.

મિજલસની રાતે જરૂર બૈતુલખ્યાલમાં આવવું અને બંદગી કરવી શિયાળામાં પાંચ વાગ્યા સુધી ઈબાદત કરીને પછી તરતજ દુઆ પડાવવી પણ બીજી રાતોએ ઘટપાટનું કામ ભલે સાત વાગ્યા સુધી ચલાવવું. ટૂંકમાં મુખીના અખ્તિયારમાં છે, જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી ચલાવે, જેમ મુખીને સગવડ પડે તેમ કરે. પણ દુઆનું કામ અડધા કલાકમાં ઉકલાવી લેવું તથા નિચે પાંચ વાગે જઈને બધા દુઆ પડે. જે રીતે અમોએ ભાઈ માણસોને સતાડાનો હુકમ કર્યો છે તેવી રીતે બાઈઓને વાસ્તે પણ આજ હુકમ છે અને બાઈઓ પણ ભાઈ માણસોની માફક શિયાળામાં હમેશાં પાંચ વાગે નિચે ઉતરીને દુઆ પડે અને અડધા કલાકમાં દુઆનું કામ ખલાસ કરે. જે ટાઈમમાં ભાઈ માણસો સતાડા નાખે એજ ટાઈમ બાઈઓ માટે મુકરર કરીએ છીએ. એજ ટાઈમમાં સતાડા નાખે. જેમ ભાઈ માણસોના પાંચ સતાડા છે તેવા જ પાંચ સતાડા એજ દિવસના બાઈઓના માટે મુકરર કરીએ છીએ અને

ઇબાદત એવી રીતે કરો જે પૈગમ્બર પોતાનું બદન મુકીને રૂહથી મએરાજ ગયા એજ પ્રમાણેની જરૂરત છે તમો બંદગી કરો. અગર જો વધુ સતાડાની જરૂર પડે તો બીજા વધુ સતાડા નાખજો. ખાનાવાદાન ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ.

તમોને આ કામ પોણોસોમાં આસાન કરી આપ્યું છે તેથી કરીને તમો આ કામની કદર નથી કરતા. તમો અમારા ફરમાન પ્રમાણે બંદગી કરો તો તમને આ કામની કદર થાય યાને ખબર પડે.

39

કરાંચી,

૪-૫-૧૯૨૦.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કરાંચીના બગીચાની બાઈઓની ખાનગી મહેમાનીમાં ફરમાવ્યું કે :

અમો કરાંચીથી રવાના થઈએ ત્યાર પછી આ ફરમાન સંભળાવજો. હવે તમારો પુલ ઘણો નઝદીકમાં ટૂટવાવાળો છે અને એક કલાક ઈબાદત અને દશોંદની જરૂરત છે. જેની દશોંદ અને ઈબાદત પુરી હશે તેને પુલસિરાત ઉતરી પાર કરવાનું સહેલું થઈ પડશે. પછી એમ નહિ કહેજો કે અમારા પીર મુરશીદે અમોને ચેતાવ્યું નહીં.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે જમાતખાનામાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

બંદગી એક કલાક બરાબર કરો અને તે એક ધ્યાનથી આજુબાજુના ખ્યાલ ન કરવા જોઈએ. જો બંદગી વખતે ખ્યાલને બહાર દોડાવશો તો ફાયદો જોવામાં નહિ આવે. બંદગી કરતી વખતે તમોએ મરી જવું જોઈએ. એક કલાક તો તમે ફનાફીઅલ્લાહ ન થઈ શકો પણ પાંચ મિનિટ અથવા એક મિનિટ ફનાફીઅલ્લાહ થાઓ તો પણ ઘણું સારું છે. તમને કોઈ તે વખતે ટાંચણી મારે અથવા બીજું કાંઈ મારે અથવા કાપે તો પણ ખબર ન પડે, એવી રીતે બંદગીમાં બેસવું જોઈએ.

ફરમાવ્યું કે બંદગી તમે એક કલાક બેસીને કરો એમ પણ નથી, તમે ખુરશી માથે બેસીને, આરામ ખુરશી માથે લેટીને, સુતાં સુતાં પણ કરી શકો છો. 'સુતે બેઠે રાહ ચલંતે નામ સાહેબજીકો લિજીએ' આ પાઠ હાઝર ઈમામે બોલીને ફરમાવ્યું કે ગમે તેવી રીતે બંદગી સુઈને, બેસીને, આડા પડીને જેમ તમોને ઠીક લાગે તેમ કરો. પણ ખ્યાલ તેની અંદરજ હોવો જોઈએ. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે વાડીમાં જૂનાગઢના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે જૂનાગઢવાળા ઘણા ઈમાની છો. અસલ જૂનાગઢમાંથી તમારાથી તથા વારસ ઈસ્માઈલથી નૂર રોશન થયું, તેના પછી આખી દુનિયામાં થયું. ઈસ્માઈલ વારસે સાઠ હઝાર માણસો ઈમાની બનાવ્યા અને દસ હઝાર માણસોને સાથે લઈ ગયો. ઈસ્માઈલ વારસ, કાસમ વારસ અને કુલ કામડિઆ ઈબ્રાહિમભાઈએ ઘણી સારી ખીજમત કરી. ઈસ્માઈલ વજીર એક હતો તો શું કરી શકે ? પણ તમે જમાતે તેને મદદ આપી. તમે પણ એનામાંથી છો. ઘણી આશિષ ફરમાવી. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે બરાબર બાર વાગે મઝગાવની વાડીમાં પંધારી મોટા કામવાળાઓને ફરમાવ્યું કે :

તમોને મોટા કામમાં દાખલ થયા ઘણા વરસો થયા તેમાં કોઈએ પણ નૂર જોયું હોય અથવા તો બંદગીમાં ખુશી પેદા થઈ હોય તે હાથ ઊંચો કરે. ત્યારે ભાઈઓમાંથી ચાર જણ અને બાઈઓમાંથી બેજણીઓએ હાથ ઊંચા કર્યા.

ફરમાવ્યું કે જે શખ્સ નૂર નથી જોઈ શકતા તેના ખાસ બે કારણ છે તે ધ્યાન દઈને સાંભળો :- (૧) તમે બંદગી કરો અને ઈમાન ચુસ્ત નહિ હશે તો નૂરને જોઈ શકશો નહીં. (૨) દશોંદનો પૈસો યાને માલેવાજેબાત તમારા પેટમાં હશે તો પણ અંધકાર પેદા થશે અને કાંઈ પણ ફાયદો કરી નહિ શકો.

ફરમાવ્યું કે હમણાં તમો ચીઠ્ઠી બદલાવવા માટે બેઠા છો પણ તમારું ઈમાન ચુસ્ત નહીં હશે તો તમોને કાંઈ પણ ફાયદો થવાવાળો નથી. તેથી તમારું ઈમાન ચુસ્ત રાખો. જ્યારે તમે કોઈ નૂરની નિશાની જોઈ નથી શકતા ત્યારે

ચીઠી શા માટે બદલાવો છો. તમે તમારી જિંદગીનાં અમૂલ્ય ટાઈમ નકામો ગુમાવો છો અને અમૂલ્ય જિંદગીના દમ ખલાસ કરો છો. તેથી કાંઈ ફાયદો થવાવાળો નથી. તમારો અને અમારો ટાઈમ નાહક નકામો જાય છે, તેથી આમ થવું ન જોઈએ.

ફરમાવ્યું કે જે છોકરીઓ ઉમર લાયક થઈ હોય તેને તરત જ શાદી કરી આપો જેથી ગુનાહના કામ થતા અટકે. તમે મોલાનું લશ્કર છો હવે જો તમે નૂરને જોઈ નહિ શકશો તો મોટા કામના નામને બદનામ કરો છો. તમને જે મળ્યું છે તે સાચું છે છતાં લાભ હાંસલ ન કરો તો તે ઘણું જ ખરાબ છે.

ફરમાવ્યું કે કેટલાકોને અમોએ સાઠ મિનિટની બંદગી આપી છે. પણ અમોએ જે ટાઈમ આપ્યો છે તેથી વધારે બેઠકમાં બેસવાથી ખ્યાલ અખંડ નથી રહેતો. માટે અમો જે ફરમાન કરીએ તે પ્રમાણે બેઠક કરો તો ઘણો ફાયદો હાંસલ કરી શકશો. ફરમાવ્યું કે રાત દિવસના ચોવીસ કલાક છે તેમાંથી અમોએ બંદગીનો એક કલાક આપ્યો છે તેમાં મનને વશ રાખી અખંડ ખ્યાલથી બંદગી કરવી જોઈએ અને એટલા વખતમાં એક એવો ટાઈમ આવશે જે નૂરને જોઈ શકશો. વધુ વખતની કાચી બંદગી કરતાં દસ મિનિટની પાકી બંદગી ઘણી સારી છે.

ફરમાવ્યું કે એ દશ મિનિટમાં તમે નૂરને જોઈ શકશો, પણ અંખડ ખ્યાલથી બંદગી કરશો તો જ તેમાં ફાયદો થશે. ફરમાવ્યું કે તમે બંદગીમાં ફનાફીઅલ્લાહ થઈ જાવ તો જલદી નૂરને જોઈ શકશો તેમાં જરાય શક નથી. ફરમાવ્યું કે તમને મોટા કામમાં દાખલ થયે ઘણાં વરસ થયા છે છતાં હજુ સુધી નૂરને નથી જોતા તે ઘણી અફસોસની વાત છે. હવે જે ફરમાન કર્યા છે તે એક કાનથી સાંભળી બીજા કાનમાંથી કાઢી ન નાખજો પણ તમારા દિલમાં કોતરી રાખજો અને પળેપળ ખ્યાલ કરજો તો લાભ થશે. આ જિંદગીના દમ ફોગટ ગુમાવવામાં શું ફાયદો છે ? માટે નૂરને જોવાની કોશીશ કરો, નૂરને જોવામાં ચાર બાબતો પાળવાની ખાસ જરૂર છે.

(૧) ચુસ્ત ઈમાન.

(૨) ચોખ્ખી દર્શોંદ.

(૩) અખંડ ખ્યાલ.

(૪) નજર સાફ અને પાક.

અમોએ હમણાં જે ફરમાન કર્યા છે તે ભૂલી જજો નહિ. બરાબર યાદ રાખજો.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ૧૧.૩૦ વાગે મઝગાવની વાડીમાં પધારી મોટા કામવાળાઓને ફરમાવ્યું કે :

ગઈ કાલના અમારા ફરમાનો શું તમોને યાદ છે કે ભૂલી ગયા ? ફરમાવ્યું કે અમોએ તમોને જે ટાઈમ આપ્યો છે તે પ્રમાણે બરાબર બંદગી કરજો અને દર હફતામાં સોમવાર રાત તથા જુમેરાતના રાતે બૈતુલખ્યાલમાં વહેલા આવીને રૂહાની વાએઝ કરવી. જે જુમેરાતના ન બને તો સોમવાર રાતના જરૂર જલદી આવી અને બૈતુલખ્યાલમાં રૂહાની વાએઝ કરવી એમાં કસૂર કરશો તો તમોને નુકશાની થશે.

ફરમાવ્યું કે અમારા ફરમાનને દરરોજ યાદ કરજો, અને એકચિત્તથી બંદગી કરજો, તમારી બિંદગીનો વખત નકામો ન જાય તેની સંભાળ રાખજો. ફરમાવ્યું કે તમારા એક કલાકના ઝીકરને ઘણું મજબુત કરજો અને દુનિયાના ખોટા ખ્યાલોનો ત્યાગ કરો, તમારા મનને મજબુત કરી બરાબર ઈબાદત કરશો તો ઈ-શાઅલ્લાહ ઘણો ફાયદો જેઈ શકશો.

ફરમાવ્યું કે દુનિયામાં ઈન્સાન છે તે પોતાની સાથે શું
લઈ જવાવાળો છે. દુનિયા કોઈની થઈ નથી અને થવાવાળી
પણ નથી. તમે અમારા નૂરને ઓળખો, જ્યારે તમે
અમારા મુરીદ થયા ત્યારે અમારા ફરમાન તમારા સીનામાં
કોતરી, એ પ્રમાણે ચાલો તો પીરી મુરીદીનો ખરો સંબંધ
ગણાય. દુઆઆશિષ ફરમાવીએ છીએ. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કાંડી મહોલામાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે મહેમાની રાખી છે તેના બદલ ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ, તેનો બદલો દીન અને દુનિયામાં આપશું. ફરમાવ્યું જે તમે કામમાં છો અને ફળ પેદા ન કરો તો શું ફાયદો ? તમે કિલ્લામાં દાખલ થયા છો તો ઈબાદત કરી જરૂર કાંઈને કાંઈ ફળ હાંસલ કરવું જોઈએ. જેઓ બૈતુલખ્યાલમાં દાખલ છે તેઓએ હમેશાં ખુશીમાં રહેવું, કદી પણ ગમીમાં રહેવું નહિ, ખુશી એવી કે જાણે મોમન સાત આસમાન માથે બહેસ્તમાં હોય તેમ ખુશીમાં રહેવું જોઈએ. ફરમાવ્યું કે તમોને તેવીસ કલાક દુનિયાના છે અને એક કલાક ઈબાદતનો છે તો એક કલાક ઈબાદત ધ્યાનથી કરવી. તે વખતે ખ્યાલ અમારામાંજ રાખવો, હાઝર ઈમામના ચરણમાં રાખવો. જેનાથી એ ખ્યાલ બીજે ઠેકાણે ન જાય, એકધ્યાનથી લીન થવું જોઈએ, કોઈ તોપ ફોડે અથવા કોઈ મારે તો પણ ખબર ન પડે તેવી રીતે લીન થવું જોઈએ. તમે રોજ જમાતખાને આવી ઈબાદત કરો છો તેવીજ રીતે વધારે કોશિશથી ઈબાદત કરતા રહેજો. ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કાંડી મહોલ્લાની બૈતુલખ્યાલ પંજેભાઈઓને ફરમાવ્યું કે :

અમો તમોને ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ અને ત્રણ વખત ખાનાવાદાન મુખ મુબારકથી ફરમાવ્યા. બાદ ફરમાવ્યું કે બૈતુલખ્યાલમાં પંજેભાઈઓ છે તે બધા આવે છે ? ફરમાવ્યું કે મોમન ઘણા છે, શાબાશ ખાનાવાદાન અને દુઆઆશિષ ફરમાવ્યા. બાદ ફરમાવ્યું જે મૌલાનું નૂર તમારા દિલમાં છે તે રોશન થાય એવી ઈબાદત કરો. મૌલાનું નૂર હમેશાં રોશન રહે અને દિલમાં અંધારું ન રહે. નૂર છે તે ચિરાગ યાને બત્તી છે, જેવી રીતે બત્તીમાં તેલ નાખવાથી રોશનીપુરણ જરૂરી રહે છે. તેમ તમે ઈબાદતનું તેલ આપો તો રોશની થશે. તો દિદારને જોઈ શકશો. ફરમાવ્યું કે ઈલેક્ટ્રીક યાને વિજળીની બત્તીમાં પાવર હોવાથી રોશનીથાય છે. તેના માટે પાવર હાઉસથી કનેક્શન રાખવો પડે છે તેમ તમે પણ હાઝર ઈમામના દિદાર માટે ઈમામના નૂરથી સંબંધ રાખો, જેનાથી રોશની કાયમ રહેશે અને હાઝર ઈમામનું નૂર તમારા દિલમાં રોશન રહેશે. તે ઈબાદત ચાલું કરવાની સાથેજ રોશની થશે. ખાનાવાદાન.

36

કરાંચી,
૨૯-૨-૧૯૨૪.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
દાતાર હાઝર ઈમામે વાડીમાં હસનાબાદની બૈતુલખ્યાલના
પંજેભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

હસનાબાદ બૈતુલખ્યાલના પંજેભાઈ અને જમાતથી
અમો ઘણા રાજી અને ખુશી છીએ, ઘણી દુઆઆશિષ
ફરમાવીએ છીએ કારણ કે હસનાબાદમાં ખોજ, મોમના,
કાઠીયાવાડી મોમના, પંજબી, બદકશાની, કરાંચીવાળા,
ગુઆઘરવાળા આ બધા ભેગા હળીમળીને રહે છે તેથી
અમો ઘણા રાજી છીએ અને તમો બધાઓને દુઆઆશિષો
ફરમાવીએ છીએ. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા જમાતખાને મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે બધા મોટા કામવાળાઓ મૌલાનું લશ્કર છો. તમે છો તે કિલ્લાની અંદરનું લશ્કર છો અને બહારનું લશ્કર તમારા ઉપર હુમલો કરે તો તમને બચાવ કરવો જોઈએ. જો તમે હિંમત કરશો તો તમારી ફતેહ છે, કારણ કે તમે કિલ્લાની અંદર છો.

અમો તમને મુશ્કીલીનું ફરમાન કરશું કે હવે અમને તમારી જરૂર પડશે. અમો તમોને ફરમાન કરીએ તે પહેલાં તમે તૈયાર થઈ રહેજો, ક્યારે પણ આ ફરમાન થાય. બાઈઓને પણ આ ફરમાન કરીએ છીએ. બધા મોટા કામવાળાઓ માટે આ ફરમાન છે. તમો બધાને આ બાબતનો વિચાર કરવાનો છે.

મુખી દાતુ ગુઆદરવાળાને ફરમાવ્યું છે તે તમો બધા વાસ્તે પણ છે. પીર સદરદીન ઈરાનથી હિંદુસ્તાનમાં આવીને તમને બોધ કર્યો હતો તેમ મુખી દાતુ અહિંથી ઈરાન તરફ જઈને મુરીદોને બોધ કર્યો છે તે ઘણું છે. બાદ દુઆઆશિષ આપી રવાના થયા.

૪૦

મુંબઈ,

૧૧-૧-૧૯૩૪.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે હસનાબાદના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું જે તમે અમારા રૂહાની બચ્ચાં છો અને હંમેશા રૂહાની બચ્ચા તરીકે રહેજો. ખાનાવાદાન.

૪૧

મુંબઈ,

૧૫-૧-૧૯૩૪.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટાખાને મોટાકામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

મહેમાની મોટા કામવાળાઓની છે ? ફરમાવ્યું તમે મોટા કામવાળાઓ ઈબાદતમાં હોંશિયાર રહેજો. અમો તમોને નસીહત કરીએ છીએ તે ભુલી નહીં જાઓ, અગર ભુલી જશો તો કામનો ફાયદો થશે નહીં. અમોએ તમને પહેલેજ કામમાં દાખલ થતી વખતે નસીહત કરી છે તે હંમેશાં યાદ રાખજો. ઈબાદતમાં ધ્યાન રાખવું જોઈએ. ઈબાદત એક કલાકની છે. એક કલાક કરતાં વધુ ઈબાદત બંધ છે. એક કલાક દિલોજાનથી ઈબાદત કરો. ચોવીસ કલાકમાં એક કલાક બરાબર બંદગી કરવી જોઈએ. દુઆઆશિષ ફરમાવીએ છીએ. તમોએ ઘણીજ ખીદમત કરી છે. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટાખાને બૈતુલખ્યાલની બાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

અમારી હાજરીમાં અમોને જોઈને તમે આવો છો પણ અમારી ગેર હાજરીમાં તમે મિજલસમાં નથી આવતા તે ઠીક નથી. તમે અમારી રૂહાની દીકરીઓ છો. અમો જ્યાં પણ હોઈએ છીએ ત્યાં તમને યાદ કરીએ છીએ. અમોને હંમેશા હાજર સમજીને ખાને આવો. હાજર નથી સમજતા ત્યારે મિજલસમાં આવતા નથી મિજલસમાં હાજરી ઘણી ઓછી છે. તમારા ઉપર બુરખો, છેડો કે ઘુંમટો નથી, તમે બહાર હરવાફરવા માટે જાવ છો તેના માટે અમો ના નથી પાડતા પણ જમાતખાને તમે શા માટે નથી આવતા ? જમાતખાને હંમેશાં આવો. એક કલાક ખુદાને યાદ કરો. એક કલાક ન બની શકે તો અડધો કલાક બેસો, અડધો કલાક ન બનીશકે તો વીસ મિનિટ બેસો, પણ ખુદાને ન ભુલો. તમે તમારા રૂહાની પિતાને કેમ ભૂલી જાવ છો ? દિવસમાં ત્રેવીસ કલાક પોતાને ધણીની, બચાંઓની, ઘરની ખિજમત કરો, એક કલાક ખુદાને યાદ કરો દુનિયાદારી તો હંમેશાં છે, પણ દીનને ભૂલી ન જાઓ. દુનિયાને હંમેશાં જુઓ છો તેવી રીતે દીનને પણ જુઓ.

૪૩

મુંબઈ,

૧૯-૨-૧૯૩૪.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે વાડીમાં કાંડી મહોલ્લાના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે ઘણી તકલીફ અને ઘણી જહેમત લઈને મહેમાની કરી છે તેના માટે દુઆઆશિષ ફરમાવીએ છીએ. જ્યારે તમારા તાર આવે છે ત્યારે પણ અમો તમને દુઆઆશિષ મોકલીએ છીએ. જ્યાં અમો હોઈએ છીએ ત્યાં તમને યાદ કરીએ છીએ, ખાનાવાદાન. તમે ભાઈઓ, બાઈઓ બધાની દસ્તખોસી કબુલ ફરમાવીએ છીએ.

ફરમાવ્યું કે જમાતખાનામાં બરાબર આવવું જોઈએ, ટાઈમસર પહોંચવું જોઈએ અને ઈબાદત કરવી જોઈએ તેમાં બિલકુલ સુસ્તી કરવી જોઈએ નહીં. ખાનાવાદાન.

૪૪

હસનાબાદ, મુંબઈ,

૨૧-૨-૧૯૩૪.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કરાંચીની બાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું:

જ્યાં હો ત્યાં દિલ બરાબર હોય તો કાંઈ ફરક નથી. ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ. ખાનાવાદાન.

૮૮

૪૫

મુંબઈ,

૧૨-૧-૧૯૩૫.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કાંડી મહોલા સતસંગની પંજેભેણુની મહેમાનીમાં પધારી ફરમાવ્યું કે :

જેઓને બાતુની દિદાર થયા હોય તે હાથ ઊંચા કરે. આ ઉપરથી બાઈઓએ હાથ ઊંચા કરતાં હાઝર ઈમામે ફરમાવ્યું કે ઘણી ઓછી છે. અહીંતહીના ખ્યાલ રાખવા નહીં. બંદગી વખતે દુનિયાના કામ કાજમાં ખ્યાલ રાખો નહીં. એક કલાક હાઝર ઈમામ સાથે સુરતી મિલાવો. પચાસ ટકા બાતુની દિદારવાળા તો હોવાજ જોઈએ. બંદગી વખતે અહિંતહીના ખ્યાલો રાખવા નહિં. ખાનાવાદાન.

૪૬

મુંબઈ,

૧૬-૧-૧૯૩૫.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કાંડી મહોલા બૈતુલખ્યાલની બાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે તમારું ઈમાન મજબુત રાખજો ઈમાન અને ઈતેકાદને સંભાળજો. દુનિયાના કામ પણ સારા કરો. આમાલ સારા રાખજો. દુનિયાનું કામ પણ શિખવું જોઈએ,

૮૯

બચાંઓને સંભાળજો અને તેઓ તંદુરસ્ત રહે તેના માટે જરૂર છે કે બાઈઓ મહિનામાં એક વખત લેકચર કરે. બચાંઓને કેવો ખોરાક આપવો તેના માટે લેકચરો કરવા તમારી ફરજ છે. ખાનાવાદાન.

૪૭

મુંબઈ,

૧૮-૧-૧૯૩૫.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કાંડી મહોલા બૈતુલખ્યાલના ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે લોક અહીં રહો છો, તમને તો નજદીક છે. બૈતુલખ્યાલમાં અઠવાડિયામાં બે વખત મિજલસમાં આવવું જરૂરનું છે. પચાસ ટકા હાઝરી જરૂર હોવી જોઈએ. દૂર રહેતા હોય તેવાઓની વાત જુદી છે. મોટા કામમાં દાખલ થયા છે તેઓએ મિજલસમાં આવવાની જરૂર છે. દાખલ થયા હોય અને નામ ન લખાવે અને હાઝરી પણ ન આપે તો શું ફાયદો ? મિજલસમાં આવવું, નામ દાખલ કરાવવું ઘણું જ જરૂરનું છે.

ઈસાઈ લોકોના મોટા મોટાઓ દરેકને ઘરે જાય છે તેમ તમે પણ મોટા લોકો દરેકને ઘરે જઈને મિજલસમાં આવવા સમજાવો એ ફરજ છે. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે બૈતુલખ્યાલ મહેમાનીમાં ફરમાવ્યું કે:

ઘણી દિલગીરીની વાત છે કે મીજલસમાં ઘણા ઓછા માણસો આવે છે. ત્રીસ, ચાલીસ કે પચાસ ટકા મિજલસમાં જરૂર હાઝરી હોવી જોઈએ. તમોએ અમારી હુઝુરમાં આવીને કામ લીધું તો હવે હાઝરી આપવી વાજબ છે, ઈબાદત એક કલાકથી વધારે નહિ, એક કલાક સરેરાશ રાખો, તે વખતે ઘડિયાળ હાથમાં રાખો નહિ, દશ પંદર મિનિટ વધુ ઓછી થાય તો ફીકર નહીં. ઈબાદત વખતે દુનિયાના અહિતહિના ખ્યાલ રાખજો નહીં. તે વખતે બધો ખ્યાલ ઝીકરમાં રાખજો, તમે ઝીકરમાં એવા બેહોશ થઈ જાવ કે તોપનો ગોળો બાજુમાંથી નિકળે તો પણ ખબર ન પડે. ઈબાદતમાં કેવી રીતે બેસવું તે હાઝર ઈમામે પોતે કરી બતાવ્યું હતું. (હાથ વડે મોઢું ઢાંકી દેવું કપાળ માથે હાથ રાખવો, એક બાજુ બેસી માથું નિચે રાખવું વિગેરે) અગર આવી રીતે બેસશો તો બીજા ખ્યાલ નહીં આવે. જેને નક્શની બક્ષિસ હોય તે નક્શ જુએ. જેને જાપ હોય તે જાપ પડે, તેમાં જીભ હલાવવી નહિ, બધા ખ્યાલ એકદમ બંધ કરી ઝીકરમાં હમણાં અમોએ

બતાવ્યું તે પ્રમાણે કરવું, બની શકે તો હમણાં કરી
 બતાવ્યું તેમ નેચરલ એટલે કુદરતી રીતે શ્વાસ ચાલતો
 હોય શ્વાસ જબરદસ્તીથી ચલાવવો નહીં. જોયું હમણાં
 અમે કેવી રીતે બતાવ્યું ? જોયું અમોએ આંખો કેમ રાખી
 હતી ? એવી રીતે તમે પણ આંખો રાખો. અગર એક
 કલાકમાં બે મિનિટ મદહોશ થાઓ તો પણ ઘણું છે.
 બાઈઓને ફરમાવ્યું કે તમોએ પણ આ જોયું ? તમારા માટે
 પણ એ જ પ્રમાણે છે. અમોએ જેવી રીતે ખુરશી પર કરી
 બતાવ્યું તેવી રીતે તમો જમીન પર પણ બેસીને કરી શકો
 છો.

બાદ ફરમાવ્યું કે મુખીયાણી કામડિયાણીની નિમણુંક
 માટે એવા નામો આપો કે જેઓ લેકચરો આપી શકે અને
 જમાતને પણ સંભાળી શકે. યુવાન અને હોંશિયાર હોય
 મોટી ઉમરની ન હોય, ચાલીસ વરસની અંદર હોય, એવા
 નામો આપો. ઈબાદતમાં તમે જે જે ચીજ અને ખુબસુરતી
 જોઈ હોય તે ભૂલતા નહીં. ખાનાવાદાન.

૪૯

દારેસલામ,

૪-૨-૧૯૩૭.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
 દાતાર હાઝર ઈમામે મોટા કામવાળા પંજેભાઈઓની
 મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમોએ ઘણી ખિજમત કરી છે અને આગળ વધવાનો વિચાર કર્યો છે તેના માટે તમોને મુબારકીઓ આપીએ છીએ. બાદ ફરમાવ્યું કે એક વાત તમોને પુછીએ છીએ જેનો સત્યતા પૂર્વક જવાબ આપજો. તમો આજ સુધી જે મહેનત લઈ બંદગી કરી, તેમાં ખુશી પેદા થઈ હોય, દિલમાં ઠંડક જણાઈ હોય અથવા અમારી તસ્વીર જોઈ હોય તેઓ હાથ ઊંચા કરે. હાથ ઊંચા થયેલા જોઈને હાઝર ઈમામે ફરમાવ્યું કે ઈબાદત કરે તેને ફાયદો જરૂર થવો જ જોઈએ. તેમજ તેને મઝા અને આનંદ દિલમાં પ્રગટ જરૂર થવો જોઈએ. પાંચ છ કારણો છે જે કારણો દૂર નથી થતાં ત્યાં સુધી ફાયદો નથી.

ઈબાદત વખતે જગ્યા, તસ્બીહ વિગેરેમાં ધ્યાન હોય તો ફાયદો નહિ થાય. ઈબાદત વખતે આસાનીથી અહિતહિનો ખ્યાલ દૂર કરી શાંત ચિત્તે બેસવું. ઈબાદત વખતે જબાન ચલાવવી નહીં. તમોને જે પવિત્ર જાપ આપેલ છે તે બરાબર યાદ રાખજો, તેની સુરત દેખાશે. જેવી રીતે સૂરજને યાદ કરો તો સૂરજ તમોને નજરમાં-ખ્યાલમાં આવશે, તેવીજ રીતે નક્શને જોવું તે ખુદાની સૂરત છે. અમો જે નક્શ આપીએ છીએ તે નામ અને નક્શ યાદ કરજો. એક કલાક ઈબાદત અહિતહિનો ખ્યાલ કર્યા વગર એક જ ધ્યાનથી કરજો, મોમનની દશોંદ પાકી હોવી જોઈએ.

હક મોલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઇમામે દારેસલામ, કીલવા, મોરોગોરો, કિલોસા, કિમાબ્યા, બાગામોયા વિગેરે જમાતની બૈતુલખ્યાલની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમો બધા મોટા કામમાં દાખલ થયેલા છો એટલે તમો જાણો છો કે અમો તમને કેટલા નજદીક છીએ તમે એમ ન સમજો કે અમો ખુરશી પર અહિં બેઠા છીએ પણ અમો તમારા દિલમાં, તમારા ધ્યાનમાં બેઠેલા છીએ. તમે પણ અમારા દિલ અને ધ્યાનમાં રાતદિન રહો. મોટા કામવાળાઓને ત્રણ ચાર બાબતોની ઘણી જરૂર છે, જે રાત અને દિવસ ભૂલવાની નથી.

(૧) ઈબાદત વખતે તકલીફ થાય તેમ બેઠક કરવી નહીં, કારણ કે બદનને તકલીફ થશે તો રૂહનું ધ્યાન અમારા તરફ રહેશે નહિં પણ તકલીફમાં રહેશે. એ ઘણું જરૂરનું છે કે જમાતમાંથી બિમારી ઓછી થાય તેના માટે અમે ફરમાન કરી તમોને રસ્તા બતાવેલ છે તે પ્રમાણે વર્તશો તો બિમારી જરૂર ઓછી થશે અને ફાયદો થશે. (૨) બીજી વાત એ છે કે ઈબાદત વખતે અહીંતહીંના ખ્યાલ કરજો

નહીં. એક કલાક અથવા અડધો કલાક ઈબાદતનો આપેલ છે. ઘણા કામકાજવાળો માણસ પણ આસાનીથી એક કલાક બેસી શકે છે. ઈબાદત વખતે પાંચ મિનિટ પણ બેહોશ અને મુરદા જેવા થઈને બેસશો તો પચાસ કલાકથી પણ વધારે ફાયદો થશે. ઈબાદત વખતે રૂહની મસ્તીમાં રહેજો. દુનિયામાં કોઈ શરાબ પીનાર માણસ કેટલો મસ્ત રહે છે તેમ તમે પણ ઈબાદતમાં મસ્ત રહેજો, છેવટ અડધો કલાક પણ મસ્ત રહેજો. (૩) જાહેરી ઈબાદત પણ છોડજો નહીં. જમાતખાને હમેશાં આવવું તે એક 'ડીસીપ્લીન' અર્થાત નિયમ પાલન કરવાનું છે. જેમ લશ્કરને કવાયતની જરૂર છે તેમ જમાતખાને આવવું પણ કવાયત છે, તેથી રૂહાની તાકાત વધે છે. (૪) દશોંદ છે તે તમારા પર ફરજ છે. ખુશીનો સોદો નથી. મઝહબનું જાહેરી રાજ્ય ચલાવવા માટે દશોંદ ફરજિયાત છે, કે જે દશોંદ થકીચાલે છે, તે તમારે આપવાની ઘણી જરૂર છે. એ તમારે માટે ફાયદાની ચીજ છે, તે દરેકે આપવી વાજબ છે.

આ બાબતો ભૂલી જવાની નથી. આ ફરમાનોથી તમને રૂહાની ફાયદો થશે. દુનિયાના ફરમાનો પાળવાથી દુન્યવી ફાયદો થશે. અમો અહિં આવ્યા છીએ ત્યારથી તમોને વખતો વખત દુનિયાના ફરમાનો કર્યા છે. તે પ્રમાણે પણ ચાલવાની જરૂર છે, માટે તે પ્રમાણે ચાલજો.

એવો ખ્યાલ ન કરતા કે અમારું ફક્ત દીનનુંજ કામ છે, છતાં પણ તમને દુન્યવી ફરમાન શા માટે ફરમાવીએ છીએ? કારણ કે અમો તમારા દીન અને દુનિયાના મા-બાપ છીએ. અમારે તો તમારા બન્ને ફાયદાઓ જોવાના છે. બંને બાબતોના ફરમાનો અનુસાર ચાલશો તો તમોને દીન અને દુનિયામાં ફાયદો થશે.

અમો હમણાં તમારી પાસે બેઠા છીએ તેમ તમે હમેશાં અમને તમારા ધ્યાનમાં જુઓ. હમેશાં યાદ રાખો કે તમો નાના બચ્ચાં નથી. તમે હમેશાં ઊંચા ખ્યાલ રાખો, તમે અમારા રૂહાની ફરજંદો છો. ફરજંદો ઘણા ઊંચા ખ્યાલ રાખે. તમારી જગ્યા ઘણી ઊંચી છે. ઘણી ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ, ખાનાવાદાન.

જે લોકો અહીં નથી આવ્યા તેઓને તમે જ્યારે તમારે ગામ જાઓ ત્યારે આ ફરમાનો સંભળાવજો તમોને જે ફરમાનો કર્યા છે તે એક બીજા સાથે બેસીને વાંચજો, તેની માયના કાઢજો, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટાકામની મહેમાનીમાં પધારી ફરમાવ્યું કે :

છેલ્લે ૧૯૨૬માં અમો આફ્રિકા પધાર્યા હતા તે દિવસથી આજ દિવસ સુધી જેઓ ગુજરી ગયા છે તેઓ ખુદાની રહેમતે પહોંચ્યા છે, અમો અમારા પોતાના મુખ મુબારકથી ફરમાવીએ છીએ કે તેઓ ખુદાની રહેમતે પહોંચ્યા છે, તેમને ઘણા દુઆઆશિષો ફરમાવીએ છીએ. મોટા કામવાળા મેમ્બરો મૌલાનું હકીકી લશકર છે મૌલાના લશકર બે છે. જ્યારે બચ્યાંઓ કામમાં દાખલ થાય છે ત્યારે તેઓનું નામ લશકર છે મોટી ઉંમરનાઓ કિલ્લામાં દાખલ થાય છે. એક કિલ્લામાં દાખલ થાય છે બીજા લશકરમાં દાખલ થાય છે. તમે હૈયાત છો ત્યાં સુધી કિલ્લામાં દાખલ રહેજો, ખાનાવાદાન.

બાદ ફરમાવ્યું કે તમારી મહોબ્બતનો તાર અમારી સાથે છે તે કદી મુકશો નહીં, તેના બે પ્રકાર છે, એક તારવાળા, બીજા તાર વગરના વિજળીમાં જેટલી તાકાત છે તેના કરતાં રૂહમાં તાકાત ઘણી વધારે છે. દુનિયા એ

જાણે છે કે ઈન્સાનમાં વિજળીથી વધારે તાકાત છે. તમારી મોહબ્બત અમારા પર છે તે કરતાં અમારી મોહબ્બત તમારા ઉપર વધારે છે. મોમન હમેશાં ખુશ રહે છે, તકલીફમાં પણ ખુશ રહે છે. ઊંચે હોય કે નીચે હોય, પણ તેની હાલત એક તરેહની હોય છે. અગાઉ ઈરાનમાં ઈસમાઈલીઓ પર તલવાર ચલાવવામાં આવી અને ગરદન મારવામાં આવી. તો જાણે પાઘડી પડી ગઈ. તેઓ ગભરાયા નહીં પણ રાજી થયા, કારણ કે મોમન લોકો ફિદા થાય છે. હાફીઝે શઅરમાં કહ્યું છે કે ‘પાઘડી પડી કે માથું?’ એવીજ રીતે મોમન હમેશાં ખુશ રહે છે. મોમનનું દિલ હમેશાં જોરાવર હોય છે. મોમન કોઈથી ડરતો નથી. હા, ખુદાથી ડરો. બાકી કોઈથી ડરો નહીં, બીજી કોઈ ચીજથી ડરો નહીં, ખાનાવાદાન.

બાદ હાઝર ઈમામે ફરમાવ્યું કે મરહુમની પાછળ જે મિજલસ કરવામાં આવે તેમાં પહેલા મુખી ‘અસ્તગફિરલ્લાહ’ પાંચ વખત મોટા અવાજથી બોલે, ત્યાર પછી બધા પોતાનો ઝિકર કરે. ઈદની મુબારકી ફરમાવીએ છીએ, ઘણી મુબારકીઓ છે કારણ કે જુબીલીની ઈદ છે.

૫૨

નઈરોબી,

૯-૩-૧૯૩૭.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટાકામની પંજેભેણુની મહેમાનીમાં ફરમાવ્યું કે :

જ્યારે તમે ઈબાદતમાં બેસો ત્યારે ઈમામને જાહેર રીતે જોજો. દુઆઆશિષો ફરમાવી ફરમાવ્યું કે તમારા રૂહાની મા-બાપને કદી ભૂલશો નહીં. અમો તમોને કદી ભૂલતા નથી, ખાનાવાદાન.

૫૩

કરાંચી,

૨૫-૧-૧૯૩૮.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે બગીચા બૈતુલખ્યાલની મહેમાનીમાં ફરમાવ્યું:

તમો મને યાદ કરો છો તો અમો પણ તમોને યાદ કરીએ છીએ, ભુલી જતા નથી. તમો અમારા રૂહાની બચ્ચાંઓ છો. રૂહાની બાપને ભૂલી જશો તો રૂહાની ફરજંદના હિસ્સામાંથી નીકળી જશો. જ્યાં સુધી તમારું ધ્યાન અમારામાં છે ત્યાં સુધી રૂહાની સગપણ છે, જ્યારે તમે અમને યાદ કરતા નથી ત્યારે રૂહાની સગપણમાં ફેર પડે છે.

૫૪

મોટા જમાતખાનામાં, મુંબઈ,

૨-૧-૧૯૩૯.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહે
બૈતુલખ્યાલ પંજેભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે:

તમે માત્ર બૈતુલખ્યાલમાં નહી રહેતા, અમારા ખ્યાલમાં
પણ રહેજો. અમોએ જે સબક આપેલો છે તેના ખ્યાલમાં
હમેશાં રહેજો, તેને ભૂલશો નહી. તમોને વખત ન મળે,
અગર બિમાર હો, તો પણ તમો શબ્દમાં ધ્યાન રાખજો.
એક કલાકથી વધારે સબક કરતા નહી. તમોને ઘણી
મુશ્કેલીઓ આવે તો પણ દરરોજ ઓછામાં ઓછી દસ
મિનિટ કે પંદર મિનિટ ખ્યાલ રાખજો. બિમાર હો તો
પણ ઓછામાં ઓછી દસ મિનિટ ખ્યાલ રાખજો. જો તમે
બિછાનામાં હો તો પણ આ કામમાં જરૂર ધ્યાન રાખજો.
ગમે તેવી હાલતમાં હો તો પણ આ સબકને ભૂલતા નહી
હમેશાં ખ્યાલ રાખજો.

૫૫

મુંબઈ,

૫-૩-૧૯૪૦.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
દાતાર હાઝર ઈમામે કાંડી મહોલા સતસંગ પંજેભેણુની
મહેમાનીમાં ફરમાવ્યું કે :

ઈબાદત વખતે દાદર ચડી જમાતખાને આવો તેથી
કસરત થાય છે ડબલ ફાયદો થશે. ખાનાવાદાન.

૧૦૦

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે કાંડી મહોલા બૈતુલખ્યાલના પંજેભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે :

તમે હમેશાં અમારી નજદીક છો. તમે જ્યારે અમારો ખ્યાલ કરો છો તે વખતે અમો તમારો ખ્યાલ કરીએ છીએ. તમારો અને અમારો ખ્યાલ ટેલીગ્રાફ માફક છે. જ્યારે તમે ખ્યાલમાં બેસો છો, ત્યારે તારથી પણ જલદી અને વિજળીથી પણ જલદી એ ખ્યાલ અમારા પાસે આવે છે. જે અમો કબુલ કરીએ છીએ. તમે સારી રીતે ખ્યાલ રાખો, ખ્યાલ કર્યા વગર તમને જવાબ નહી મળી શકે. તમારા ખ્યાલ અને અમારો જવાબ હમેશાં બંને સાથે રહે છે. આખી દુનિયાને ખબર છે કે અમારો મઝહબ બાતુની છે. જ્યારે બાતુની ખ્યાલ પાકો થાય છે એ વખતે ઘણું સંભાળો, તે વખતે ઈમામનો ખ્યાલ કરો. ત્રેવીસ કલાક રૂહને દુનિયામાં રાખો પણ એક કલાક રૂહને અમારા પાસે મોકલી આપો. પીર સદરદીને ફરમાવ્યું છે કે ખ્યાલમાં મરી જવું જોઈએ. એવી રીતે તમો ચોવીસ કલાકમાંથી એક કલાક મરી જાઓ. જો એવી રીતે એક કલાક મરી ન શકો તો બૈતુલખ્યાલનો કાંઈ ફાયદો નથી. અમારું આ ફરમાન ભૂલજો નહીં, બરાબર યાદ રાખજો. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કે :

અમો તમોને અમારા કિલ્લામાં દાખલ કરીએ છીએ.
તમે અમારું લશ્કર છો. તમોને દુઆઆશિષ ફરમાવીએ
છીએ. ખાનાવાદાન.

તમે અહિંયા કોઈના કહેવાથી કે જબરદસ્તીથી કે
રાજી ખુશીથી આવ્યા છો ? (બધાએ કહ્યું રાજી ખુશીથી)

બાદ ફરમાવ્યું કે પરોઢીયે ચારથી પાંચ વાગ્યા સુધી
એટલે કે એક કલાક હમેશાં બંદગી કરવી. ઘડિયાળ બાજુમાં
રાખવી નહિ કારણ કે તેથી તમારું ધ્યાન તેમાં જશે. દશ
મિનિટ ઓછી વધુ થાય તો વાંધો નહિ. અગર એકધ્યાનથી
બેસશો તો અડધો કલાક પણ બસ છે. તે વખતે મુડદા
જેવા થઈ જાઓ. કોઈ તોપનો અવાજ થાય તો પણ
તમને ખબર ન પડે.

દુઆ ત્રણ વખત જમાત સાથે હમેશાં પડવી, પણ
જો કોઈ કારણસર જમાતખાને ન પહોંચી શકાય તો
યાઅલીની અથવા પીરશાહની ત્રણ તસ્બીહ કાઠી લેવી
એટલે દુઆ કબુલ થશે.

દશોંદ બરાબર આપવી. જો લશ્કર પાસે બંદુકમાં ગોળી ન હોય તો લશ્કર કેવી રીતે લડી શકે ? દશોંદ છે તે બંદુકની ગોળી માફક છે. માટે દશોંદ બરાબર આપજો.

જવાન માણસોએ જલ્દી શાદી કરી લેવી. બદનજર કરવી નહિ. અગર બદનજરી કરશો તો આ કામનો ફાયદો થશે નહિ. ઝિકરનો શબ્દ જબાનથી બોલવો નહિ પણ મનમાં તેનું રટણ કરવું.

(૧) કોઈના પર જુલ્મ કરવો નહિ, તેમજ કેસ માંડવો નહિ. (૨) કોઈ તમારા પર જુલ્મ કરે તો બચાવ કરવો. (૩) મોઢામાંથી કોઈને ખરાબ શબ્દ બોલવા કે ગાળ દેવી નહિ. (૪) બંદગી વખતે શરીરને જેમ ઠીક લાગે તેમ બેસવું, કારણ કે શરીરને તકલીફ પડે તેમ બેસશો તો તમારું ધ્યાન તકલીફમાં જશે.

બાદ દુઆઆશિષ ફરમાવી ફરમાવ્યું ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મુલાકાતની ચીઠ્ઠી વખતે મોટા કામવાળા બાઈઓ અને ભાઈઓને ફરમાવ્યું કે :

આપણા મઝહબનું નામ બાતુની મઝહબ છે. દુનિયાના બધા જાહેરી મઝહબો કહે છે કે મરવા બાદ બહેશત છે, મરવા બાદ ફાયદાઓ થશે, જ્યારે આપણા બાતુની મઝહબની માયના એ છે કે અહિંયા, આ દુનિયામાંજ પોતાની હૈયાતીમાં બહેશત અને ફાયદો જોઈ શકાય છે. અલબત્ત બદનમાં રૂહ કેદ છે ત્યાં સુધી ફાયદો જોઈ નહિ શકે. ઈન્સાનનો રૂહ બદનના કેદખાનામાં કેદી છે. એવું તો મુશ્કીલ છે કે એક, બે કલાક બદનમાંથી બહાર નિકળી ફાયદો જોઈ શકાય. પરંતુ એક કલાકમાં એક મિનિટ પણ મળી જાય (એમ કહીને ચપટી વગાડીને ફરમાવ્યું) તો કાફી. નાદાન આદમી એ વાત કહી પણ દીએ તો પણ તે માણસ કે જેણે એ ખુશી નથી જોઈ કે અનુભવી તે શું સમજશે ? જેણે આંબો ખાધો નથી તેને શું ખબર પડશે કે આંબો આવો છે અને તે તેવો છે એમ કહેશે પણ તેને સ્વાદ કે લિજ્જતની શું ખબર પડશે ?

જુઓ બીજી વાત એ છે કે તમારું ઈમાન પાકું હોવું

જોઈએ. વગર ઈમાને કાંઈ પણ ફાયદો નથી. ઈમાન એવી ચીજ નથી કે ખુદબખુદ, એની મેળે દોડતું આવે, તેના માટે જે પ્યાર રાખે છે, તલબ કરે છે, તેની પાછળ દોડે છે, તેને જ મળે છે.

અમો જ્યારે ફરમાવીએ છીએ કે તમો અમારા રૂહાની ફરજંદ છો. તો તે ફક્ત જબાની સભ્યતા કે વખાણના માટે નથી. પણ અમો રૂહના મા-બાપ એવી રીતે છીએ કે જેવી રીતે તમારું જીસ્મ તમારા દુનિયાના મા-બાપથી પેદા થયું છે; તેમ તમારી રૂહાનીઓ ઈમામથી પેદા થઈ છે. દુનિયાનાં બચ્ચાં પોતાના મા-બાપનું કલ્ચું નથી માનતા તો કેવા ખરાબ થઈ જાય છે? તેવી રીતે રૂહાની બચ્ચાંઓ જેઓ રૂહાની મા-બાપ ઈમામનું ફરમાન નથી માનતા તેઓ ખરાબ થઈ જાય છે. બેટો પોતાના બાપની નાફરમાની કરે તો તેનો સંબંધ તુટી જાય છે તેમ તમારું ઈમાન અને આમાલ સારા નહિ હોય તો અમો પણ તમારાથી મહોબ્બત નહિ કરીએ અને સંબંધ તુટી જશે. મિસાલ આ હસનાબાદના કુબાના ઉપર સોનાનો કળશ છે તેની નીચે પાયો મજબુત છે તેથી રલ્યો છે, નહિ તો રહી શકે નહિ, તેમ મોટા કામનું ફળ છે તે (હસનાબાદના કુબા પરના સોનાના કળશ તરફ હાથ કરી બતાવતાં ફરમાવ્યું કે) આ સોના માફક છે અને મકાનનો નીચેનો પાયો મજબુત છે તે ગોચા ઈમાન છે. જો ઈમાન રૂપી પાયો મજબુત નહિ

હશે તો નૂરરૂપી સોનું કેવી રીતે હાથ આવશે ?

ઈમાન આપોઆપ નથી આવતું પણ બિલાડી ચુવાને પકડવા કેવી હોંશિયાર સાવચેત અને આતુર હોય છે ? ઈમાન રૂપી નૂર માટે પણ તેવીજ આતુરતા અને હોંશિયારીની જરૂરત છે.

આ કામ માટે ત્રણ ચાર શરતો છે. પહેલી બાબત છે કે ઘડિયાળ તમારી દુશ્મન છે, સબબ તમે તે તરફ ઘડી ઘડી જુઓ છો અને તેનો ખ્યાલ કરો છો અમો એક કલાક ફરમાવીએ છીએ તેની મતલબ એ નથી કે ઘડિયાળની સામે જોઈને સાંઈઠ (૬૦) મિનિટ ઈબાદત કરવી. તમો ઈબાદતમાં એવા મશગુલ થઈ જાઓ કે તમને ખબર પણ ન પડે. ચાલીસ મિનિટ પણ થાય ને એંસી (૮૦) મિનિટ પણ થાય. ઈબાદત વખતે આરામથી બેસવું. શરીરમાં દર્દ કે તકલીફ ન થાય એવી રીતે બેસવું. જો તકલીફ કે દરદ થશે તો તમારો ખ્યાલ શરીરના દુખાવામાં જશે.

ઈબાદત કરતી વખતે ખ્યાલો અહીંતહીં ક્યાં પણ દોડાવવા નહીં. દુનિયાના ખ્યાલો કરવા નહી. રેલગાડીમાં પણ ઈબાદત કરી શકો છો, તે એવી રીતે કે બાજુમાં બેઠેલા પેસેન્જરોને પણ ખબર ન પડે કે તમે શું કરો છો, ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે હસનાબાદમાં મોટા કામમાં દાખલ થનાર બાઈઓ ભાઈઓમાં પધારી ફરમાવ્યું કે :

તમો આ કામમાં દાખલ થાઓ છો અને જે ચીજ તમને મળે તેની બીજા પાસે વાત કરતા નહિ. આ બહુજ જરૂરની વસ્તું યાદ રાખજો કે આની વાત બીજા પાસે કરવી નહિ.

તમે કોઈની સાથે દુશ્મની કરતા નહી. દુશ્મનીનો મતલબ એ નથી કે આપણો હક કોઈની પાસેથી નહીં લેવો, પણ બીજાના હક ઉપર ત્રાપ મારવી નહીં.

મોમનને વાજબ છે કે જરૂર જમાતખાને જઈને દુઆ પડે. દુઆ નહિ પડે તે મોમન નથી. દુનિયાના કામકાજમાં ગુંથાએલા હો, મુસાફરીમાં હો, જંગલમાં હો તો 'યા અલી' 'યા મૌલા' 'યા મહમદ' 'પીરશાહ' 'યા અલ્લાહ'ના નામની સો પારાની એક તસ્બીહ પડી લેવી.

જે દશોંદ નથી આપતો તે ઈસ્માઈલી નથી. દશોંદ વગર ઈમામનું રાજ્ય કેમ ચાલે ? ઈમામની જરૂરત હોય

તો દશોંદ આપો અને જો ઇમામની જરૂરત ન હોય તો પછી તમારી ખુશીની વાત છે. વગર ટેક્ષે (Tax) દુનિયાનું રાજ્ય પણ ચાલતું નથી. દશોંદ આપી ઇસ્માઈલી વાવટો ઊંચો કરો.

કોઈએ બદનજર કરવી નહીં. ઇન્સાન છે તેનાથી ભુલ થઈ જાય છે, માટે ઉંમર લાયક છોકરા છોકરીઓએ શાદી કરી લેવી. શાદી કરી લેવી એ આપણા મઝહબમાં છે. એવું નથી કે શાદી નહીં કરવી.

જ્યારે રાત પુરી થાય અને સૂરજ ઊગે તે પહેલાં એક કલાક ઇબાદત કરવી. તેમાં પાંચ મિનિટ ઓછી કે વધું થાય તેમાં કાંઈ વાંધો નથી.

ઘડિયાળથી નુકશાન થાય છે ઘડિયાળ સારી નથી, તેનાથી તમારો ખ્યાલ સ્થિર નથી રહી શકતો. તમો બધાને જે ઝીકર છે, તે મનથી બોલવો અને જે નક્શ આપીએ છીએ તે નજરની સામે રાખવો.

ઇમામના જાહેર નૂરને જોવાની ઇચ્છા રાખતા હો તો તે ઇબાદતમાં જોઈ શકાય છે.

ઇબાદતમાં દરરોજ એક કલાક બેસવું અને તેની બધી સમજ તમને મીશનરીઓ આપશે. ખાનાવાદાન.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા જમાતખાને મોટા કામમાં દાખલ થનાર બાઈઓ ભાઈઓમાં પધારી ફરમાવ્યું કે :

અમે જે ફરમાનો કરીએ છીએ તે ખુદ તમારા પોતાના માટે છે, તેની બીજા કોઈને વાત કરવી નહી. કોઈ સાથે દુશ્મની કરવી નહીં, તેનો અરથ એ નથી કે પોતાને બરબાદ થવા દેવું. જો હુમલો થાય તો બરાબર બચાવ કરવો. બરાબર પોતાને મજબુત રાખવું. દુશ્મનીનો અર્થ એ કે બીજા કોઈ સાથે ચોરી કે દગલબાજી કરવી નહીં. જો તમારી સાથે કોઈ ચોરી કે દગલબાજી કરે તો તમારે તમારું પોતાનું બરાબર રક્ષણ કરવું.

કોઈ પારા બાઈએ ભાઈ ઉપર અને ભાઈએ બાઈ ઉપર બદનજર કરવી નહીં. બદનજર કરવાથી આ કામનો ફાયદો થતો નથી. તેના માટે દિલ પાક અને સાફ જોઈએ. જો દિલ નાપાક હશે, ગલીચ હશે તો આ કામનો ફાયદો નહિ થાય.

મોમન ઉપર વાજબ છે કે શાદી કરી લે. શાદી કરી લે તોજ બદનજર થતી અટકે. જો કોઈ લગ્ન નહીં કરશે

તો બદ નજર થઈ જશે. આપણા ઈસમાઈલી મઝહબમાં શાદી કરી લેવી વાજબ છે.

જે તમારી દુઆ છે તે બરાબર પડવી જોઈએ. જે દુઆ પડવાનું ન બને અને કામકાજના અંગે વખત ન મળે તો સો વખત 'યા અલી' 'યા અલ્લાહ' 'યા મહમદ' 'પીરશાહ'નું નામ લેવું. આ એક તસ્બીહ કાઢવી જોઈએ. આવી એક તસ્બીહ કાઢવાથી દુઆ કબુલ થશે.

દશોંદ આપવી એ મોમનની ફરજ છે. દશોંદ છે તે ઈમામનો ટેક્સ (tax) છે. દુનિયાનું રાજ પણ ટેક્સ (tax) વગર ચાલતું નથી. ઈમામને દીન સાથે દુનિયાનો કારોબાર ચલાવવો પડે છે.

આ દુનિયા છે. આખરત નથી. તેની અંદર ઈમામનો વાવટો ઊંચો રહેવો જોઈએ. જેને ઈમામની જરૂર નથી તેની વાત જુદી છે. પરંતુ જેને ઈમામની જરૂર છે, તેની ફરજ છે કે દશોંદ આપે. તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી. જે આ પ્રમાણે તમે તમારી ફરજ અદા કરશો તો બાતુની ફાયદો થશે.

બાતુની ઈબાદત એક કલાકની હોવી જોઈએ. સૂરજ ઊગે તેની પહેલા એક કલાક બંદગી કરવી જોઈએ, પરંતુ તેમાં ઘડિયાળની જરૂરત નથી. ઘડિયાળ ઉપર ધ્યાન

નહિ આપવું. ઘડિયાળ સારી નથી. પચાસ મિનિટ
પણ થાય કે વધુ પણ થાય. જેમ માણસ મરી જાય તેવી
હાલતમાં ખ્યાલમાં બેસવું. એવું ધ્યાન કરીને બેસવું જોઈએ
કે તમને કોઈ હાથ લગાડે તો પણ ખબર ન પડે.

દિલથી ઈબાદત કરવી જોઈએ. ખ્યાલ ઝીકરમાં રાખવો.
જ્યાં ત્યાંના ખ્યાલ નહિ કરવા અને મનથી ઈબાદત કરવી.
જીભથી નહીં. તમારો ઝીકર છે તે મનથી બોલવો અને
તેના નક્સ ને ઝીકર બોલતી વખતે નજરની સામે રાખવો.
ખાનાવાદાન.

૬૧

મુંબઈ,

૧૪-૧-૧૯૫૦.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ
દાતાર હાઝર ઈમામે મોટા જમાતખાને મોટા કામમાં દાખલ
થનાર બાઈઓ ભાઈઓમાં પધારી ફરમાવ્યું કે :

તમે આ લશ્કરમાં દાખલ થયા છો તેના માટે તમને
દુઆઆશિષ ફરમાવીએ છીએ અને મુબારકી આપીએ
છીએ. આ કામની વાત કોઈની પાસે કરવી નહીં. આ જે
બાબત છે તે તમારા પોતાના માટે છે, બીજા પાસે વાત
કરવાનો હુકમ નથી. છોકરાએ કોઈ પણ છોકરી ઉપર અને
છોકરીએ છોકરા ઉપર બદ નજર કરવી નહીં.

આ દુનિયા છે, આકબત નથી. જો લગ્ન નહિ કરો

૧૧૧

તો બદનજરી થવાનો સંભવ છે. બદનજરી ન થાય તેનો આ ઈલાજ છે કે જે બચ્ચાંઓ ઉંમરલાયક થાય તેમના લગ્ન કરી આપવા જોઈએ. જે ગરીબ માણસ છે તે પણ રોટલી તો ખાય છે, તો જેઓ એકલા છે તેઓ જોડાય અને ભેગા મળીને ખાય તો બરકત થાય.

દરેક મોમન ઉપર વાજબ છે કે વખતસર દુઆ બંદગી કરવી જોઈએ. જે દુઆ પડવાનું તમારાથી ન બની શકે તો એક તસ્બીહ 'પીરશાહ' 'યા ઈમામ' 'યા મહમદ' 'યા અલી' 'યા ખુદા'ના નામની પડે તો તેઓની દુઆ તરીકે અમો કબુલ ફરમાવશું.

પડથાર ઉપર પાંચ સાલમાં દાખલ થનાર બાઈઓ ભાઈઓમાં પધારી ફરમાવ્યું :

આગા હસનઅલી શાહના જમાનામાં જ્યારે દુનિયાનું રાજ હતું નહી પણ દીનનું રાજ હતું ત્યારે મુરીદોએ અરજકરી કે ઈસ્માઈલીઓ મિસરમાં ખિજમત કરતા હતા એવો લાભ અમોને કેમ મળે ? ત્યારે આગા હસનઅલી શાહ દાતારે તેઓને ફરમાવ્યું કે તમો એક વરસ પોતાનું કામકાજ કે ધંધો વેપાર કરી તેમાંથી રૂપિયા એકસો બચાવી એક બાજુ રાખો, એમ પાંચ વરસના પાંચસો રૂપિયા ભેગા થાય ત્યારે એ પાંચસો મારી હુઝુરમાં રાખવાથી તમને એ ખિજમતનો સવાબ મળશે. આવી રીતે તેઓ પાંચ વરસની ખિજમતના બદલામાં પાંચ વરસની કમાઈ

આપતા હતાં.

નૂરૂમ મુબીન વાંચો, અમારા બાપ-દાદાઓ મિસરમાં રાજ્ય કરતા હતાં તે વખતે મુરીદો અમારા ઘરની પાંચ વરસ સુધી પોતાના ખરચે સેવા કરતા હતા, ત્યારે આ કામની બક્ષિસ થતી હતી. આજે બાર મહિનામાંની કમાઈના એક સો રૂપિયા લઈને અમો પાંચ વરસની ખિજમત કબુલ કરીએ છીએ.

આજે તો બાર મહિનાની ઘણીજ કમાઈ છે. એક માણસને હાઝર ઈમામે પૂછ્યું હાલમાં બાર મહિનાની કેટલી કમાઈ છે ? જવાબમાં તેણે અરજ ગુજરી જે ખુદાવંદ હઝારો રૂપિયા. ત્યારે મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું 'થાઉઝંડ રૂપિયા !'

ત્યાર બાદ ફરમાવ્યું તમોએ આ કામ કર્યું છે તે તમારા ઈશકની નિશાની છે. તમારો ઈશક અને મહોબ્બત જોઈને અમે ઘણા ખુશી થયા છીએ. અમે તમારો ઈશક અને મહોબ્બત હમેશાં જોવા માગીએ છીએ. તમારા ઈશક અને મહોબ્બતથી રૂહાની રાજ ચાલે છે, અગર જો તમારો ઈશક અને મહોબ્બત ન હોય તો રૂહાની રાજ કેમ ચાલે ? અમો તમારી, અમારા ઘરની પાંચ વરસની ખિજમત કબુલ ફરમાવીએ છીએ.

ત્યાર બાદ નીયાજ બનાવી આપી ફરમાવ્યું : 'તમો સહુ આ નીયાજ પીને પછી જજો. ઘણી ઘણી દુઆઆશિષ ફરમાવીએ છીએ. ખાનાવાદાન.'

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહે મોટા કામવાળા બાઈઓ ભાઈઓમાં પધારી ફરમાવ્યું કે :

પઈસાવાળા અને ગરીબોએ શાદીમાં ધામધુમ કરવી એ આપણા ઈસમાઈલી મઝહબમાં હરામ છે. શાદી વખતે ધામધુમ કરવી બહુ જ ખરાબ છે. ફુઝુલ ખરચ કરવો નહિ જોઈએ. ખાલી દાદ ચુકવી નીકાહ પડાવી આપો.

જે દશોંદ નથી આપતો તે ઈમામના રાજને નથી ચાહતો. આ દુનિયા છે. દુનિયાની અંદર મઝહબ ચલાવવા ખરચ થાય છે. તમે તમારા ઈમામને દશોંદ આપી તમારા વાવટાને ઊંચો રાખો.

હવે તમને આ કામના ફરમાન કરીએ છીએ. આની વાત કોઈની પાસે કરવી નહીં તે માટે તમે અમને વચન આપો. સવારની નજદીક એક કલાક બંદગી કરવી. બંદગીના માટે એક કલાક છે પણ ઘડિયાળ હાથમાં રાખવી નહીં. સુમાર અને અકલથી સમજી લેવું પછી ભલે ચાલીસ અથવા એંસી મિનિટ થાય કાંઈ ફીકર નહીં. દુનિયાના ખ્યાલ એક કલાક બિલકુલ કરવા નહીં. બંદગીમાં આરામથી બેસવું શરીરને તકલીફ થાય તેવી રીતે બેસવું નહીં. જો તકલીફ થાય તેવી રીતે બેસશો તો ખ્યાલ બરાબર નહિ રહે. બંદગી વખતે આખો બંધ કરવી. ઝબાન નહિ હલાવવી. મનથી ઝીકર કરવું. જે જાપ અમે આપીએ

છીએ તે મનથી બોલજો. નકસને નજરમાં રાખજો અને અમારા દિદારને સામે રાખજો. જાપ મનથી બોલજો. જેમ તમે મનથી બોલો 'દિલ્હી' 'આગરા' એવી રીતે ઝબાન હલાવ્યા વગર મનથી જાપ બોલવો.

કોઈ ભાઈએ બાઈ ઉપર અને બાઈએ ભાઈ ઉપર બદનજર કરવી નહિ. બદનજર થઈ જાય એ કુદરતી છે અને તેનો ઈલાજ છે કે ઉંમર લાયક છોકરા છોકરીઓએ શાદી કરી લેવી જોઈએ, છોકરાની ઉંમર ૨૦, ૨૧, ૨૨ અને છોકરીની ઉંમર ૧૭, ૧૮ બસ છે, બધાને દુઆઆશિષ આપીએ છીએ. ખાનાવાદાન.

૬૩

કરાંચી,

૯-૨-૧૯૫૦.

હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે મોટા કામની મહેમાની રજૂ થતાં ફરમાવ્યું કે :

તમો અમારા તરફથી સહુને દુઆઆશિષ આપજો. એકે એકને દુઆઆશિષ આપજો. તેઓને સમજવજો કે દાખલ થવાના પહેલે દિવસ અમે શું ફરમાનો ફરમાવીયા હતા ? અને તે ફરમાનો તેઓ બીલકુલ ભુલી ન જાય. તેઓને અમોએ શું રાઝ (રહશ્યો) આપીયા છે, તે પણ ભુલી ન જાય અને તે બરાબર બંજાંવે અને તેના પર બરાબર રીતે ચાલે. ખાનાવાદાન.

મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું કે :

નૂરના વખતે મારા સઘળા મુરીદોને હું દુઆ ફરમાવું છું બે કલાક નૂરની વેળાએ મારા સઘળા મુરીદોને દીન અને દુનિયામાં સારૂ થાય એવી દુઆ ફરમાવું છું.

સુતેલા માણસને જાગ્રત કરવામાં આવે તેમ હું તમોને નૂરની વેળાએ ઈબાદતમાં મશગુલ થવા જાગ્રત કરું છું અને કહું છું કે ઉઠો, ઈબાદતમાં મશગુલ થાઓ, ત્રણ વાગાની ઈબાદતમાં મશગુલ થવાથી ઘણો ફાયદો થશે, એક તરફ આખી દુનિયાનો માલ તથા બીજી તરફ ઈબાદત એવું ઈબાદતનું જબરૂં વજન છે.

અમારા વ્હાલા રૂહાની બચ્ચાંઓ, અમો તમોને અમારા સહવાસમાં આવવા આમંત્રણ આપીએ છીએ, તે આમંત્રણ પ્રત્યે તમો લક્ષ આપતા નથી, ધારો કે ગામનો હાકમ મોટી લાગવગ વાળો કોઈ સરકારી અમલદાર તરફથી સાંજના ૪ વાગે જવા અને ત્યાંથી સાથે મોટરમાં ફરવા જવા માટેનું તમોને સ્નેહ ભર્યું આમંત્રણ મળે તો દિલમાં કેવી ખુશી અને અભિમાન થશે ? આમંત્રણના ટાઈમથી બે ચાર મિનિટ વહેલા સુંદર વસ્ત્રો પરીધાન કરીને ત્યાં પહોંચી જશો. ત્યારે અમે પાછલી રાતે ચાર વાગે અર્શે-

અઝીમની સહેલગાહ કરવા માટે પોતાના બંગલે આવવા તમોને આમંત્રણ આપીએ છીએ છતાં તમો તે વખતે જાગી તમારું દિલ જે પાક ખુદાનો બંગલો છે તેમાં સરજાણહારનો પવિત્ર દિદાર કરવા તમો તૈયાર થતા નથી. આ નૂરની વેળાએ સુસ્ત બની નિંદ્રાને વશ થઈ જિંદગીની ઉત્તમ-અમુલ્ય તક ગુમાવો છો અને પાક ખુદાના સહવાસથી દૂર રહી ભવિષ્યની નિરાશા પોષો છો.

અમારા સહવાસમાં રહેનારની જિંદગી દરેક રીતે નિર્ભય બને છે. તેને નથી હોતી કારણની ધાસ્તી કે તેને નથી હોતી કોઈ આફત બલાની ધાસ્તી. તેના દિલમાં કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી હોતો. પરંતુ અમો જે સર્વશક્તિમાન માતા અને પિતાથી પણ વધુ સંભાળ રાખનાર, પાલન-પોષણ કરનાર, પતિ-પત્નીથી પણ વધારે સુખ આપનાર ભાઈ-બહેનથી પણ વધારે સંબંધ રાખનાર, પુત્ર અને પુત્રી કરતાં પણ વધારે ઘડપણમાં સેવા ચાકરી કરનાર, આ લોક અને પરલોકમાં રહેલાં તમામ દુઃખો અને ભયમાંથી બચાવનાર, દરેક સમય અને હાલતમાં સાથે રહેનાર, આ દેહમાં અને દેહ છોડ્યા પછી એક ક્ષણમાત્ર તમારાથી દૂર નહિ રહેનાર, દરેક બાબતમાં દરેક વખતે વફાદાર રહી મદદ આપનાર અમો માલિક પાક પરવરદીગારની સંગતમાં રહેનાર તમો કેટલા સુખી અને ભાગ્યવંત કહેવાવ ?

આવા ભાગ્યશાળી જીવનું દીલ હમેશાં શાંત, સુખી અને સંતોષી હોય છે, કારણ કે તેના સર્વે કામો અમો પાક ખુદા પોતે કરીએ છીએ, તમારી સઘળી ઉમેદો અમોને સોંપેલી હોવાથી તમો ભાગ્યશાળી ઈન્શાનના કામો અમો પાક પરવરદીગારની કૃપાથી આપો આપ થતા આવે છે. આજ સુધીની જિંદગીમાં આવા સુખી વખતનો અનુભવ તમોએ ન લીધો હોય, તો આ જગત પ્રત્યે અર્થહીન ખેંચ અને બીન જરૂરી બોજો દિલ ઉપરથી ઉતારી કામ કાજ કરો.

ખુદાના દિદારનો તલબગાર ઈન્સાન, ખુદાના દિદારની પ્રાપ્તી ચોક્કસ કરી શકે છે, જો ઈચ્છા કરશો તો જરૂર મળશે, દરવાજો ખખડાવશો તો તે જરૂર ખુલશે. બાદ મૌલાએ ફરમાવ્યું કે તમારા પગ નીચે માયાનો ગંજ છે તેના ઉપર ધુળ વળી ગયેલ છે, તમો એટલી મહેનત નથી કરતા કે તે ધુળને એક બાજુ કરો, જેથી તે ખજાનો તમારા હાથમાં આવે, તે વસ્તું જરાયે દૂર નથી, બહુ જ નજદીક છે છતાં થોડી જેટલી પણ એક દિલથી સંપૂર્ણ ધીરજની સાથે મહેનત કરશો તો અવશ્ય લાભ પ્રાપ્ત થશે. ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન.

ઈમામે ફરમાવ્યું કે

ઝવાહીર મહાસાગરમાં ઉંડે હતું. તેને એક કુંજમાં રાખેલ છે, તમો પણ હિંમતથી એક ચિંત્તથી અને ચોખ્ખા

દિલથી ઝીકર કરશો તો તમો બહુ જ થોડા સમયમાં આ
એ ઝવાહીર હાથ કરી શકશો.

તમો રાત અને દિવસ બંદગી કરો છો, છતાં તેનો તમોને કાંઈપણ લાભ મળતો નથી, તેનું કારણ એ છે કે તમો પારકી નિંદા કરી તમારા આત્માને કલંકીત બનાવો છો.

અમો માણસના એબ ઉપર પડદો ઢાંકિયે છીએ, જ્યારે તમો નાચીઝ ઈન્શાન ખુદાના કાર્યથી વિરુદ્ધ જઈ, તમારા રૂહને બિમાર અને શક્તિહીન બનાવી દયો છો.

તમો અમારું નામ લ્યો તે બસ નથી, પણ મને યાદ કરો એટલે કે ફામમાં લાવો, આમ કરવાથી તમારા દિલમાં અમારું નૂર રોશન થશે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં તમે જાવ ત્યારે ત્યાં ત્યાં અમોને તમારી બાજુમાં જ રાખજો અને એવા ખ્યાલથી કે અમો તમારી પાસે હાઝર મૌજુદ છીએ, અમોને તમારા સાથે રાખો, તમારા દિલમાં બેસાડો, અમારો સાથ કદી ન છોડતા.

અમો શહેનશાહના પણ શહેનશાહ છીએ અને તમારા સાચા દોસ્ત છીએ, જેથી અમારી ઝહુરાતને તમારા દિલમાં રાખજો અને નિરંતર અમારો સાથ લેજો કે જેમાં પૈસાની બીલકુલ જરૂર નથી.

પિતળનો રંગ બદલાય છે. તેથી તેની કિંમત નજીવી

છે. સોનાનો રંગ બદલાતો નથી, જેથી તે કિંમતી છે. તેવીજ રીતે તમારા હૃદયનો રંગ પલ્ટો ન થાય, તો તેવા હૃદયની કિંમત ન થઈ શકે, આવા હૃદય અમુલ્ય હોય છે. તમો થોડો વખત બંદગી કરી પછી છોડી દીધો છો એ બીલકુલ બરાબર નથી, ઈબાદત બંદગી કરતી વખતે ભુતકાળમાં થયેલા ગુન્હા, ભૂલચૂકથી થતા ચાલુ ગુન્હા, ખરાબ ખ્યાલો અને કરેલું દાન પૂણ્ય તેમજ તમારી સઘળી ઉમેદો અમોને સોંપી તમારું દિલ તદ્દન હળવું કરી અમોને તમારા દિલમાં પ્યારથી પ્રગટાવો, દુન્યવી વિચારો આવે તો જરા પણ હતાશ ન થશો એ ભાર દિલ ઉપરથી તરત કાઢી નાંખી ઝીકરનું રટણ ચાલુ જ રાખજો. સંપૂર્ણ પ્રેમથી એક ઘડી, એક પળ, અમારા પ્રત્યે જો ધ્યાન ટકાવો તો તમોએ આખી દુનિયાની દૌલતનું દાન કર્યું લેખાશે, જ્યાં સુધી તમારું ધ્યાન ઈબાદતમાં નથી, ત્યાં સુધી તે વસ્તું તમારા નઝરમાં આવતી નથી. તમો શાંતિપૂર્વક બંદગી કરો, બંદગી ધીરજ પૂર્વક અને અતિ પ્યાર અને વિનયથી કરજો.

humility/composition

૧ હું સાત જમીન અને આસમાનમાં નથી સમાતો પણ મારા મોમનોના દિલમાં હું આરામથી રહી શકું છું.

જે અમારા દિદારની ઈચ્છા કરે છે, તેના માટે અમારા દિદાર મૌજુદ છે.

ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન.

૬૫

કરાચી,
૨-૭-૧૯૦૦

બચતુલખચાલવાળાઓ માટે ગીરીયાઝારી

હઝરત ઈમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાવ્યું કે
ખુદાવંદ પાસે અરજ કરવી,

યા ખુદાવંદ પોતાના મુરીદ ઉપર રહેમની નજર કરજો,
ગુન્હા બક્ષજો, મારા અવગુણ સામે નહી જોઈ પોતાની
મહેર કરીને લખ ચોરાસીના બંધનમાંથી છોડાવજો, હું
ઘણા દિવસનો વિછડેલો (જુદો પડેલો) છું, માટે મહેરબાની
કરીને અસલમાં વાસલ કરજો, વહેલા થઈ પોતાનો દિદાર
દીયો, પોતાની મહેર કરીને અસલ નૂર હુઝુરપુરમાં દાખલ
કરજો.

ખાનાવાદાન....